



ખજાને કે અમબાર

KHAZANE KE AMBAAR (GUJARATI)



દરિયા મેં ઘોડે દીડા ટિયે	1
માથે કસ્તીર મેં કર્ણી ખુફ્યા તદભીર તો નહીં ?	8
ગુનાલો કો અચ્છા સમજના કુફ હે	10
આણત સે નજીત કા જરીબા	22
વીડિયો સેન્ટર ખત્મ કર ટિયા	28
માથ જમ્બન કરને ન કરને કી ચૂરતે	29
અંગૂઠી કે 17 મ-દની કૂલ.	36

શૈખ તરીકત, આમીરે અહેલે સુણાત, બાળિયે દા'વતે છલાભી, હિન્દુત અલ્લામા મૌલાના અનુ જિવાલ
મુહુમ્માદ ઈલ્�બ્યાસ અચાર કર્મિંદી ૨-૩૫૧૮

الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلٰوةُ وَالسَّلَامُ عَلٰى سَيِّدِ الْمُرْسَلِينَ
أَمَّا بَعْدُ فَاعُوذُ بِاللّٰهِ مِنَ الشَّيْطَنِ الرَّجِيمِ بِسْمِ رَبِّ الْرَّحْمَنِ الرَّحِيمِ

હિતાગ પઢનો કી હુએ

અઝ : શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત, બાનિયે દા'વતે ઈસ્લામી, હજરત અલ્લામા મૌલાના અભૂ બિલાલ મુહમ્મદ ઈલ્યાસ અતાર કાદિરી ૨-૫૧૩ વી. ડામત બ્રિકાન્થેની અનાયાસ અતાર કાદિરી ૨-૫૧૩ વી.

દીની કિતાબ યા ઈસ્લામી સબક પઢને સે પહોલે જૈલ મેં દી હુઈ હુએ પઠ લીજિયે જો કુછ પઢેંગે યાદ રહેગા. હુએ યેહ હૈ :

اللّٰهُمَّ افْتَحْ عَلَيْنَا حِكْمَتَكَ وَانْشُرْ
عَلَيْنَا رَحْمَتَكَ يَا ذَا الْجَلَالِ وَالْأَكْرَامِ

તરજમા : એ અલ્લાહ ઉર્જુજી ! હમ પર ઈલ્મો હિકમત કે દરવાજે ખોલ દે ઓર હમ પર અપની રહમત નિષાવર ફરમા ! એ અ-જમત ઓર બુજુર્ગી વાલે ! (المُسْتَطْرَف ج ૧ ص ૫، دارالذکر بیروت)

નોટ : અવ્યાલ આધિર એક એક બાર હુરુદણ શરીફ પઠ લીજિયે.



તાલિબે ગમે મદીના
વ બડીઅ
વ મજફરત

28 રજુલ મુહર્જુન 1426 હિ.

www.dawateislami.net

ખાગો કે અગાર

યેહ બયાન (ખાગો કે અગાર)

શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત, બાનિયે દા'વતે ઈસ્લામી હજરત અલ્લામા મૌલાના અભૂ બિલાલ મુહમ્મદ ઈલ્યાસ અતાર કાદિરી ૨-૫૧૩ વી. જિયાઈ ને ને ઉર્દૂ જબાન મેં તહરીર ફરમાયા હૈ.

મજલિસે તરાજિમ (દા'વતે ઈસ્લામી) ને ઈસ બયાન કો ગુજરાતી રસ્મુલ ખત મેં તરતીબ દે કર પેશ કિયા હૈ ઓર મકત-બતુલ મદીના સે શાઅએઅ કરવાયા હૈ. ઈસ મેં અગર કિસી જગા કમી બેશી પાએ તો મજલિસે તરાજિમ કો (બ જરીઅએ મકતૂબ, ઈ-મેઈલ યા SMS) મુતલાચ ફરમા કર સવાબ કર્માઈયે.

રાખિતા : મજલિસે તરાજિમ (દા'વતે ઈસ્લામી)

મકત-બતુલ મદીના

સિલેક્ટેડ હાઉસ, અલિફ કી મરણાદ કે સામને, તીન દરવાજા,

અહમદ આબાદ-૧, ગુજરાત, ઈન્ડિયા

MO. 9374031409

E-mail : translationmакtabhind@dawateislami.net

الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعُلَمَائِ وَالصَّلٰوةُ وَالسَّلَامُ عَلٰى سَيِّدِ الْمُرْسَلِينَ
أَمَّا بَعْدُ فَاعُوذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيمِ يسِّرِ اللّٰهُ الرَّحْمٰنُ الرَّحِيمُ

અમાનો કે અરણારૂ¹

[શૈતાન લાખ સુસ્તી દિલાએ યેહ બયાન (39 સફાત) મુક્ખમાલ પછ લોજિયે।
અન શાءَ اللّٰهُ عَزَّوَ جَلَّ]

આપ કો ફિકે આભિરત કી દૌલત ઓર હુન્યા સે બે રગની કી ને' મત મુયરસર આએગી।

100 હાજતેં પૂરી હોંગી

સુલ્તાને દો² જહાન, મદ્દીને કે સુલ્તાન, રહમતે આ-લમિયાન,
સરવરે ઝિશાન કા ચલીલાલું ઉદ્દેશ્ય કરી કે કા ફરમાને જન્મત નિશાન હૈ :
“જો મુઝ પર જુમુઆ કે દિન ઓર રાત 100 મર્તબા દુરુદ શરીર પઢે
અલ્લાહ તાલા ઉસ કી 100 હાજતેં પૂરી ફરમાએગા, 70 આભિરત
કી ઓર 30 હુન્યા કી ઓર અલ્લાહ તાલા એક ફિરિશતા મુકર્રર
ફરમા દેગા જો ઉસ દુરુદે પાક કો મેરી કબ્ર મેં યું પહોંચાએગા જૈસે
તુમ્હેં તહાઈફ પેશ કિયે જતે હોએ, બિલા શુભા મેરા ઈલમ મેરે વિસાલ કે
બા'દ વૈસા હી હોગા જૈસા મેરી હયાત મેં હોએ.”

(جَمِيعُ الْجَوَامِعُ لِلسُّلْطَانِيِّ ج 7 ص ١٩٩ حديث ٢٢٣٥٥)

صَلَوَاتُ اللّٰهِ عَلٰى مُحَمَّدٍ
صَلَوَاتُ اللّٰهِ عَلٰى الْحَبِيبِ!

દરિયા મેં ઘોડે દૌડા દિયે

અમીરુલ મુઅમિનીના, ગૈઝુલ મુનાફિનીના, ઈમામુલ
દિને

1 : યેહ બયાન અમીરે અહેવે સુન્તાત ને તજવીજે કુરાનાનો સુન્તાત કી
આલમગીર ગેર સિયાસી તહરીક દા'વતે ઈસ્લામી કે આલમી મં-ઇની મર્ક્ઝ ફેઝને મદ્દીના
કે અન્દર સુન્તાતોં ભરે ઈજટિમાઅ (શબે બરાઅત સિ. 1431 હિ./27-7-10) મેં ફરમાયા.
તરમીમ વ ઈજાફે કે સાથ તહરીરન હાજિરે ખિદમત હૈ. મજાહિરે મક-ત-બતુલ મદ્દીના

ઉર્ગુજારાને મુખ્યમાન હશે : જિસ ને મુજ પર એક ભાર દુઃખ પાડ પણ આલ્લાઈ
ઉસ પર દસ રહ્મતો લેજતા હૈ.

(સુરિલન)

આદિલીન, મુતામ્મિમુલ અર-બઈન, ખલી-ફતુલ મુસ્લિમીન હજરતે
સાચ્છિદુના ફારુકે આ'જમ રૂપીલું ઉને કે દૌરે ખિલાફત મેં હજરતે
સાચ્છિદુના સા'દ બિન અબી વક્કાસ રૂપીલું ઉને કી સિપહ સાલારી
મેં “જંગે કાદિસિયા” મેં લશ્કરે ઈસ્લામ ને શાનદાર કામ્યાબી હાસિલ
કી, ઈસ જંગ મેં 30 હજાર મજૂસી યા'ની આતશ પરસ્ત મૌત કે ઘાટ
ઉત્તરે જબ કે 8 હજાર મુસ્લિમાનોં ને જામે શહાદત નોશ કિયા.
“કાદિસિયા” કી અઝીમુશશાન ફિલ્હ કે બા'દ હજરતે સાચ્છિદુના સા'દ
બિન અબી વક્કાસ રૂપીલું ઉને ને બાબિલ તક આતશ પરસ્તોં કા
તાકુબ કિયા ઔર આસ પાસ કે સારે અલાકે ફિલ્હ કર લિયે. ઈરાન
કા પાયએ તખ્ત (CAPITAL) મદાઈન જો કે દરિયાએ દિજલા કે
મશરિકી કનારે પર વાકેઅ થા, યહાં સે કરીબ હી થા. અમીરુલ
મુઅમિનીન હજરતે સાચ્છિદુના ફારુકે આ'જમ કી
હિદાયત કે મુતાબિક હજરતે સાચ્છિદુના સા'દ મદાઈન
કી તરફ બઢે, આતશ પરસ્તોં ને દરિયા કા પુલ તોડ દિયા ઔર
તમામ કશ્ટિયાં દૂસરે કનારે કી તરફ લે ગયે. ઉસ વક્ત દરિયા મેં
ખૌફનાક તૂઝાન આયા હુવા થા ઔર ઉસ કો પાર કરના બ જાહિર
ના મુભિન નજર આતા થા, હજરતે સાચ્છિદુના સા'દ બિન અબી
વક્કાસ રૂપીલું ઉને ને યેહ કેફિયત દેખી તો આલ્લાઈ કા
નામ લે કર અપના ઘોડા દરિયા મેં ડાલ દિયા ! દૂસરે મુજાહિદીન ને
ભી આપ કે પીછે પીછે અપને ઘોડે દરિયા મેં ઉતાર દિયે ગોયા :

દશત તો દશત હેં દરિયા ભી ન છોડે હમ ને

બધરે જુલ્માત મેં દૌડા દિયે ઘોડે હમ ને

દેવ આ ગયે ! દેવ આ ગયે !!

દુષ્મનોં ને જબ દેખા કે મુજાહિદીને ઈસ્લામ દરિયાએ દિજલા

કરમાણે મુખલાકા : حَسْلَ اللَّهُ تَعَالَى عَلَيْهِ وَالْحَمْدُ لِلَّهِ : જો શપસ મુજ પર દુઃદું પાક પઢના ભૂલ ગયા વાહ જનતા કા રાતા ભૂલ ગયા.

(ત-બચાની)

કે કુન્કારતે હુએ પાની કા સીના ચીરતે હુએ મદાના વાર બઢે ચલે આ રહે હું તો ઉન કે હોશ ઉડ ગએ ઔર “ડિયાસ આ મદન્દ” (યા'ની દેવ આ ગએ દેવ આ ગએ) કહતે હુએ સર પર પૈર રખ કર ભાગ ખડે હુએ. શાહે કિસ્રા કા બેટા યજ્ઞ ગર્દ અપના હરમ (યા'ની ધર કી ઔરતોને) ઔર ખજાને કા એક હિસ્સા પહલે હી “હુલ્વાન” ભેજ ચુકા થા અબ ખુદ ભી મદાઈન કે દરો દીવાર પર હસરત ભરી નજર ઠાલતા હુવા ભાગ નિકલા. હજરતે સાચ્છિદુના સા'દ બિન અબી વક્કાસ રضી الل્હુ ટુ હુલ્વાન” મેં દાખિલ હુએ તો હર તરફ ઈશ્વર નાક સન્નાટા છાયા હુવા થા, કિસ્રા કે પુર શિકૌહ મહલ્લાત, દૂસરી બુલન્દો બાલા ઈમારાત ઔર સર સબ્જો શાદાબ બાગાત જબાને હાલ સે હુન્યાએ હું (યા'ની હકીર હુન્યા) કી બે સબાતી (યા'ની ના પાએદારી) કા એ'લાન કર રહે થે. યેહ મન્જર દેખ કર બે ઈષ્ટિયાર હજરતે સાચ્છિદુના સા'દ બિન અબી વક્કાસ રضી الل્હુ ટુ હુલ્વાન કી જબાને મુખારક પર પારહ 25 સૂ-રતુહુખાન કી આયત નમ્રાર 25 તા 29 જારી હો ગઈ.

كَمْ تَرَكُوا مِنْ جَنَّتٍ وَعُيُونٍ^{١٥}
وَرُزُقٍ وَمَقَامٍ كَرِيمٍ^{١٦} وَنَعْمَةٍ
كَانُوا فِيهَا فَكِهِينَ^{١٧} كَذِلِكَ
وَأَوْرَثُهَا قَوْمًا أَخْرَيْنَ^{١٨} فَمَا
بَكَتْ عَلَيْهِمُ السَّمَاءُ وَالْأَرْضُ
وَمَا كَانُوا مُنْظَرِيْنَ^{١٩}

૧૨-જ-માઓ કલ્યાલ ઈમાનઃ કિતને છોડ ગએ બાગ ઔર ચેશમે ઔર ખેત ઔર ઉમદા મકાનાત, ઔર ને'મતે જિન મેં ફારિગુલ બાલ થે, હમ ને યૂંહી કિયા, ઔર ઇન કા વારિસ દૂસરી કૌમ કો કર દિયા, તો ઉન પર આસ્માન ઔર જમીન ન રોએ ઔર ઉન્હે મોહલત ન દી ગઈ.

જીસની મુખ્યતા કંઈએ : જીસ ને પાસ મેરા કિંડ હુવા ઔર ઉસ ને મુજ પરહૃદણે પાક ન
પઠા તહીંક વોહ બદલાતું હો ગયા।
(ઈને સુન્નો)

સોને કા ઘોડા ઓર સોને કી ઊંટની

મદાઈન સે મુસલ્માનોં કો માલે ગનીમત મેં કરોડોં દીનાર (યા'ની કરોડોં સોને કે સિક્કોં) કા ખજાને કા અમ્ભાર હાથ આયા જિસ મેં નિહાયત હી નાદિરો નાયાબ ચીજેં થીં, ઉન મેં સે કુછ કે નામ યેહ હુંણેં : ઈરાન કે મશાહૂર આતશ પરસ્ત બાદશાહ નૌ શેરવાં કા ઝર નિગાર (યા'ની સોને કા) તાજ, શાહાને સલફ (યા'ની ઈરાન કે ગુજરે હુએ બાદશાહોંને યાદગાર હીરોં) સે જડાવ ખન્જર, જિરહેં, ખૌદ ઓર તલવારેં, ખાલિસ સોને કા કદ આવર ઘોડા જિસ કે સીને પર યાકૂત જડે થે, ઉસ પર સોને કા બના હુવા એક સુવાર થા જિસ કે સર પર હીરોં કા તાજ થા, ઈસી તરહ એક તિલાઈ (યા'ની સોને કી) ઊંટની ઓર ઉસ કા તિલાઈ (યા'ની સોને કા) સુવાર. ઐવાને કિસરા (યા'ની ઈરાન કે બાદશાહોંને શાહી મહલ) કા તિલાઈ ફર્શ યા'ની સોને કા કાલીન (CARPET) જો બેશ કીમત જવાહિરાત સે આરાસ્તા થા ઓર ઉસ કા રકબા 60 મુરબ્બાં ગજ થા વગેરા વગેરા. મુસલ્માન માલે ગનીમત જમ્બું કરને મેં એસે દિયાનત દાર સાબિત હુએ કે તારીખે આલમ ઈસ કી મિસાલ પેશ કરને સે કાસિર હૈ, અગર કિસી મુજાહિદ કો એક મા'મૂલી સી સૂર્ય મિલી યા કીમતી હીરા, ઉસ ને બિલા તઅમુલ ઉસે ખજાને કે અમ્ભાર મેં શામિલ કરવા દિયા.

(البداية والنهاية ج ٤، تا ١٣٥ ص ٤، بتصريف وغيره)

ખજાને કે અમ્ભાર કી પુકાર

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! દેખા આપ ને, હમારે અસ્લાહે કિરામ ને બકાએ ઈસ્લામ કે લિયે કેસે કેસે જાં બાજાના

જીશમાણ મુખ્યતા : ﴿كُلُّ إِنْسَانٍ تَعْبُدُهُ اللَّهُ وَالْمُؤْمِنُونَ﴾ : જિસ ને મુજ પર દસ મરતાબા સુખ ઓર દસ મરતાબા શામ દુઃદૈયાડ્યાં ઉસે હિયામત ડે ટિન મેરી શક્યાત મિલેગી। (મજમુ'જુજવાઈદ)

ઈકદામ ફરમાએ ! ઈસ હિકાયત સે હજરતે સાચિદુના સા'ં દ બિન અબી વક્કાસ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ કી બે મિસાલ કરામત ભી સામને આઈ કે આપ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ ને બે ખતર અપના ધોડા દરિયાએ દિજલા કી બિફરી હુદ્દ મૌજો મેં ડાલ દિયા ! ઔર યેહ ભી મા'લૂમ હુવા કે ખ્વાહ કિતના હી બડા ખજાને કા અમ્ભાર હો બિલ આખિર બેકાર હો કર રહ જાતા હૈ. અથ એક બહુત બડે ગફકત શિઆર ઈસરાઈલી માલદાર કી ઈશ્વત નાક હિકાયત આપ કે ગોશ ગુજાર કરતા હૂં, અગર આપ કા દિલ જિન્દા હુવા તો ઈસે સુન કર إِنَّ اللَّهَ عَزَّوَ جَلَّ આપ કો ખજાને કે અમ્ભાર બિલકુલ બેકાર મહસૂસ હોને લગેંગે ચુનાન્યે દા'વતે ઈસ્લામી કે ઈશાઅતી ઈદારે મક-ત-બતુલ મદીના કી મત્ભૂઆ 412 સફહાત પર મુશ્તમિલ કિતાબ “ઉધ્યુનુલ હિકાયાત” હિસ્સાએ અવ્યલ સર્ફણા 74 પર નકલ કર્દા હિકાયત કા ખુલાસા મુલા-હજા ફરમાઈયે : હજરતે સાચિદુના યઝીદ બિન મૈસરહ رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ ફરમાતે હું કે પહલી ઉમતો મેં એક માલદાર મગર કન્જૂસ શાખસ થા, વોહ **અલ્લાહ** عَزَّوَ جَلَّ કી રાહ મેં કુછ ભી ખર્ચ ન કરતા, હર વકત કસ્રતે ધન કી ધુન (યા'ની દૌલત કી લગન) મેં મગન રહતા ઔર ઈસ કી પૈહમ કોશિશ રહતી કે બસ કિસી તરહ માલ બઢતા રહે. ઉસ ના આકિબત અન્દેશ, હરીસે માલો દૌલત કી જિન્દગી કે શબો રોજ અપને અહલો ઈયાલ કે સાથ ખૂબ ઐશો ઈશરત ઔર નિહાયત ગફકત કે સાથ બસર હો રહે થે. એક ટિન ઉસ કે ઘર કે દરવાજે પર કિસી ને દસ્તક દી. ઉસ ગાફ્લિલ દૌલત મન્દ કે ગુલામ ને દરવાજા ખોલા તો સામને એક ફકીર કો પાયા, આને કા મકસદ પૂછા, જવાબ મિલા : જાઓ ઔર અપને માલિક કો બાહર ભેજો, મુજે ઉસ સે કામ હૈ. ગુલામ ને ઝૂટ બોલતે હુંએ કહા : “વોહ તો તેરે હી જૈસે કિસી ફકીર કી મદદ કરને બાહર ગયે હું.” ફકીર

હુશમાણે મુર્ખવણ : ﷺ : જિસ ડે પાસ મેં કિડ હુવા ઔર ઉસ ને મુજ પર દૂકણ
શરીફ ન પઠા ઉસ ને જફા તી.

(આધુર્યોજીકા)

ચલા ગયા. કુછ દેર બા'દ દોબારા દરવાજે પર દસ્તક પડી, ગુલામ ને
દરવાજા ખોલા તો વોહી ફીરી નજર આયા, અબ કી બાર ઉસ ને
કહા : જાઓ ! અપને આકા સે કહો, મૈં મ-લકુલ મૌત (عَلَيْهِ السَّلَامُ)
હું. ઉસ માલ કે નશે મેં ધૂત ઔર યાદે ખુદા ﷺ સે ગાફિલ શાખ્સ કો
જબ યેહ પતા ચલા તો થર્ચા ઊઠા ઔર ઘબરા કર અપને ગુલામોં સે
કહુને લગા : “જાઓ ઔર ઉન સે ઇન્તિહાઈ નરમી કે સાથ પેશ
આઓ.” ગુલામ બાહર આએ ઔર મ-લકુલ મૌત (عَلَيْهِ السَّلَامُ) કી મિન્તા
સમાજત કરતે હુએ અર્જ ગુણાર હુએ : “આપ હમારે આકા કે બદલે
કિસી ઔર કી રૂહ કબજ કર લીજિયે ઔર ઉસે છોડ દીજિયે.” આપ
ને ફરમાયા : “ઐસા હરગિઝ નહીં હો સકતા.” ફિર ઉસ
માલદાર શાખ્સ સે કહા : તુઝે જો વસિય્યત કરની હૈ અભી કર લે, મૈં
તેરી રૂહ કબજ કિયે બિગેર યહાં સે નહીં જાળિંગા. યેહ સુન કર વોહ
માલદાર શાખ્સ ઔર ઉસ કે અહલો ઈયાલ ચીખ ઉઠે ઔર રોના ધોના
મચા દિયા, ઉસ શાખ્સ ને અપને ઘર વાલોં ઔર ગુલામોં સે કહા :
સોને ચાંદી ઔર ખજાનોં કે સન્દૂક ખોલ કર મેરે સામને ઢેર કર દો.
ફૌરન હુકમ કી તા'ભીલ હુઈ ઔર ઉસ કે સામને જિન્દગી ભર કે
જમ્બ કિયે હુએ ખજાને કા અમ્બાર લગ ગયા. ખજાને કે અમ્બાર કો
મુખાતબ કર કે વોહ માલદાર શાખ્સ કહુને લગા : “એ જલીલ વ બદ
તરીન માલો દૌલત ! તુઝ પર લા'નત ! મૈં તેરી મહિય્યત કી વજહ સે
બરબાદ હુવા, હાએ ! હાએ ! મૈં તેરે હી સબબ સે આલ્લાન્
કી ઈબાદત ઔર તથારિયે આખિરત સે ગાફિલ રહા.” ખજાને કે
અમ્બાર સે આવાજ આઈ : એ માલો દૌલત કે પરસ્તાર પક્કે હુન્યા
દાર ઔર ગફિલત શિઆર ! મુજે મલામત ક્યું કરતા હૈ ? ક્યા તૂ
વોહી નહીં જો હુન્યા દારોં કી નજરોં મેં જલીલો ખ્વાર થા ! ફિર મેરી

કર્માને મુખ્યતાકા : ﴿كُلُّ النَّدَاءٍ تَعْالَى عَلَيْهِ الْحَمْدُ وَسَلَامٌ﴾ : جો મુજ પર રોજે જુમુઆ દુઃદશરીક પહેગા મૈં ડિયામત કે દિન
ઉસ તી શફાઅત કરેંગા। (કલ્જુલ અમાર)

વજણ સે આબરૂ દાર બના ઓર તેરી રસાઈ શાહી દરબાર તક હુઈ,
મેરી હી બદૌલત તેરા નિકાહ માલદાર ખાનદાન મેં હુવા, યકીનન
યેહ તેરી હી બદ બખ્તી હૈ કે તૂ મુજે શૈતાની કામોં મેં ઉડાતા રહા,
અગર તૂ રાહે ખુદા મેં ખર્ચ કરતા તો યેહ જિલ્લતો રૂસ્વાઈ તેરા મુક્કદર
ન બનતી, બતા ! ક્યા બુરે કામોં મેં ખર્ચ કરને ઓર નેક કામોં મેં સર્જ
ન કરને કા મશવરા મેં ને દિયા થા ? નહીં, હરગિઝ નહીં, તુઝે પેશ
આને વાલી તમામ તર તબાહી કા જિભેદાર તૂ ખુદ હી હૈ, (ઇસ કે
બા'દ સચ્ચિદુના મ-લકુલ મૌત ને ઉસ કન્જૂસ માલદાર કી રૂહ
કળું કર લી) (عُيُونُ الْحَكَايَات (عَرَبِي) ص ٤٩ مُلْحَصًا دار الكتب العلمية بيروت)

દૌલતે દુન્યા કે પીછે તૂ ન જી આખિરત મેં માલ કા હૈ કામ ક્યા ?

માલે દુન્યા દો જાહાં મેં હેવ બાલ કામ આયેગા ન પેશે જુલ જલાલ

(વસાઈલ બજીશા, સ. 375)

صَلَوَاتُ اللَّهِ عَلَى مُحَمَّدٍ وَآلِهِ وَسَلَامٍ

.....જ બ ચિદિયાં ચુગા ગંડી ખેત

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! આપ ને માલો દૌલત કે દીવાને
કી કાબિલે ઈબ્રત હિકાયત સમાયત ફરમાઈ કે ઐસા શાખ્સ જો ઉત્ત્ર
ભર ઐશ કોશિયોં ઓર નફસાની જ્વાહિશોં કે પીછે પડા રહા,
અલ્હાન કી તરફ સે મિલી હુઈ ઢીલ સે બજાએ સંભળને કે
ઉસ કી ગફલતોં કા સિલ્સિલા તવીલ હોતા ચલા ગયા, માલ કે નશે
મેં મખ્ખૂર, ગરીબોં ઓર મોહત્તાજોં કી ઈમદાદ સે દૂર ઓર અધ્યાશિયોં
મેં મસરૂર રહા. આખિરે કાર “એક દિન મરના હૈ આખિર મૌત હૈ”
કે મિસ્ટાક મૌત કા ફિરિશ્તા આ પહોંચા, અગર્યે ઉસ વક્ત માલ કા
ખુમાર ઉતરા, હોશ ઠિકાને આએ લેકિન “અબ પછ્યાએ ક્યા હોત

કશમાને મુખ્યત્વાના : ﷺ : મુજ પર દૂષેણ પાક કી કસરત કરો બેશક યેહ તુમ્હારે
લિયે તહારત હૈ.

(અભૂયા વા)

જબ ચિદિયાં ચુગ ગઈ ખેત.” માલો દૌલત કે હરીસ અફરાદ જિન્હેં
હુન્યા વ આખિરત કે બરબાદ હોને કી કોઈ ફિક નહીં હોતી ઉન કે
લિયે ઈસ હિકાયત મેં દર્સે ઈબ્રત કે બે શુમાર મ-દની ફૂલ હૈને.

ધુપ અંધેરી કબ્ર મેં જબ જાએગા	બે અમલ ! બે ઇન્તિહા ઘબરાએગા
કામ માલો ઝર વહાં ન આએગા	ગાફિલ ઈન્સાં યાદ રખ પછતાએગા
જબ તેરે સાથી તુરે છોડ આએગે	કબ્ર મેં કીરે તુરે ખા જાએંગે

(વસાઈલે બજીશાશ, સ. 376)

صَلَوٰةٰ عَلَى الْحَبِيبِ ! صَلَوٰةٰ عَلَى مُحَمَّدٍ

માલે કસીર મેં કહીં ખુફ્યા તદબીર તો નહીં ?

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! યેહ હકીકત હૈ કે બા'જ અવકાત
અલ્લાહ ઉર્વોહી કસરતે માલો મનાલ સે નવાજ કર ભી આજમાઈશ મેં
ડાલ દેતા હૈ, જેસા કે દા'વતે ઈસ્લામી કે ઈશાઅતી ઈદારે મકત-બતુલ
મદીના કી મત્બૂઆ 1548 સફહાત પર મુશ્તમિલ કિતાબ “ફેઝાને
સુનાત” જિલ્દ અવ્યલ સફહા 682 પર હૈ : સિદ્ધહત કી ને'મત ઔર
દૌલત કી કસરત અક્સર મુખ્તલાએ મા'સિયત કર દેતી હૈ, લિહાજા
જો (હસીન વ શાનદાર યા) ખૂબ જાનદાર યા (અબર દસ્ત) માલદાર યા
સાહિબે ઈજિતદાર હો (ઉસ કો ખુદાએ અલીમ વ ખબીર કી ખુફ્યા
તદબીર સે બહુત જિયાદા ડરને કી ઝરૂરત હૈ, જેસા કે હજરતે સયિદુના
હસન બસરી ફરમાતે હૈને : “જિસ શાખ્સ પર અલ્લાહ
ઉર્વોહી હુન્યા મેં (રોજી મેં ખૂબ કસરત, ફરમાં બરદાર ઔલાદ કી ને'મત,
માલો દૌલત, હસીન સૂરત, અચ્છી સિદ્ધહત, મન્સબે વજાહત, ઓહુદાએ
વજારત યા સદારત યા હુકૂમત વર્ગોરા કે ઝરીએ) ફરાખી કરે મગર (ઉસે
યેહ અન્દેશા ન હો કે કહીં યેહ (આસાઈશાં) અલ્લાહ કી ખુફ્યા
તદબીર તો નહીં, તો ઐસા શાખ્સ અલ્લાહ કી ખુફ્યા તદબીર
સે ગાફિલ હૈ.”

(تَبَيِّنَ الْمُعْتَرِفُونَ ص ٢٨ دار المعرفة بيروت)

કશમાને મુખલાકા : تَسْأَلُ اللَّهُ تَعَالَى عَلَيْهِ وَالْهُوَ أَعْلَمُ : تुમ જહાં ભી હો મુજ પર દુઃદુઃદ પણો કે તુમ્હારા દુઃદુઃદ
મુજ તક પહોંચતા હૈ. (ત-વાસની)

તો યેહ અલ્લાહ કી તરફ ઉંગુંજ સે ઢીલ હૈ

ખબરદાર એ જીનદાર ! ખબરદાર એ શાનદાર ! ખબરદાર
એ માલદાર ! ખબરદાર એ સરમાયા દાર ! ખબરદાર એ સાહિબે
ઈક્ષિતદાર ! ખબરદાર એ અફસર વ ઓહદે દાર ! રજ્બે અગ્રીજ વ
કદીર ઉંગુંજ કી ખુફ્યા તદબીર સે ખબરદાર ! ખબરદાર ! ખબરદાર !
કહી ઔસા ન હો કે મિલી હુદ્ધ જાની, માલી યા હુકૂમતી ને'મતોં કે
ગરીએ ગુલ્મ, તકબ્બુર, સરકશી ઔર તરહ તરહ કે ગુનાહોં કા સિલ્લિલા
બઢતા રહે ઔર કસા કસાયા સુડોલ (યા'ની ખૂબ સૂરત) બદન ઔર
માલ વ ધન જહનનમ કા ઈધન બનને કા સબબ બન જાએ. ઈસ કિન્મ મેં
હદીસે ન-બવી ઉલ્લભ માઝ આપતે કુરાઓની સુનિયે ઔર
અલ્લાહ કી ખુફ્યા તદબીર સે થર્ડીયે : હજરતે સાયિદુના
ઉકબા બિન આમિર પ્રચારિત ઉન્હેં નાભિયે અકરમ, નૂરે
મુજસ્સમ, રસૂલે મુહૂતશમ, શાહે બની આદમ કા
કરમાને ઈબ્રાત નિશાન હૈ : “જબ તુમ દેખો કે અલ્લાહ દુન્યા મેં
ગુનાહગાર બન્ને કો વોહ ચીજેં દે રહા હૈ જો ઉસે પસન્દ હોય તો યેહ ઉસ
કી તરફ સે ઢીલ હૈ. ફિર યેહ આપતે કરીમા તિલાવત ફરમાઈ :

فَلَيَسْ سُوَامِدٌ كَرُوا بِهِ فَتَحَنَّا
عَلَيْهِمْ أَبُوا بَكْلٌ شُعْطٌ حَتَّى
إِذَا فِرِّخُوا بِهَا أُوتِيُوا أَخْذَنَهُمْ
بَعْثَةً فَإِذَا هُمْ مُبْلِسُونَ

(٤٤، ٧، آલાનુમ: આયિت ٤)

૧૨-જ-મણે કલ્યાણ ઈમાન : ફિર
જબ ઉન્હોંને ભુલા દિયા જો નસીહતે
ઉન કો કી ગાઈ થી, હમ ને ઉન પર
હર ચીજ કે દરવાજે ખોલ દિયે યહાં
તક કે જબ ખુશ હુએ ઉસ પર જો ઉન્હેં
મિલા તો હમ ને અચાનક ઉન્હેં પકડ
લિયા અબ વોહ આસ ટૂટે રહે ગયે.

(مسنુ إمام أحمد ج ٦ ص ١٢٢ حدیث ١٧٣١٣ دار الفکر بیروت)

કરમાણ મુખ્યત્વા : ﴿كَلَّا إِنَّمَا تَتَعَالَى عِنْدِهِ الْحُكْمُ﴾ : જિસ ને મુજ પર દસ મર્તિબા દુષ્ટે પાક પઢા અલ્લાહ હું હું
ઉસ પર સો રહ્મતોં નાભિલ કરમાણ હૈ (ત-બાળી)

ગુનાહો કો અચ્છા સમજના કુઝ હૈ

મુફ્ફિસિસરે શાહીર, હકીમુલ ઉમત મુફ્તી અહમદ યાર ખાન
ઈસ આયતે કરીમા કે તથ્યત “તફસીરે નૂરુલ ઈરફાન” મેં
કરમાતે હૈને : ઈસ આયતે કરીમા સે મા’લૂમ હુવા કે ગુનાહ વ મઆસી
કે બા વુજ્દુ દુન્યવી રાહતોં મિલના અલ્લાહ કા ગાજબ ઔર
અજાબ (ભી હો સકતા) હૈ કે ઈસ સે ઈન્સાન ઔર જિયાદા ગાંધીલ
હો કર ગુનાહ પર દિલેર હો જાતા હૈ, બલ્કે કભી ખ્યાલ કરતા હૈ કે
“ગુનાહ અચ્છી ચીજ હૈ વરના મુજે યેહ ને’મતેં ન મિલતીં” યેહ કુઝ
હૈ. (યા’ની ગુનાહ કો ગુનાહ તરખીમ કરના ફર્જ હૈ ઈસ કો જાન બૂજ
કર અચ્છા કહના યા અચ્છા સમજના કુઝ હૈ. કુફિયા કલિમાત કી
તફસીલાત જાનને કે લિયે દા’વતે ઈસ્લામી કે ઈશાઅતી ઈદારે
મકત-ત-બતુલ મદીના કી મત્બૂઆ 692 સફહાત પર મુશ્તમિલ કિતાબ
“કુફિયા કલિમાત કે બારે મેં સુવાલ જવાબ” કા મુતા-લાય ફરમાઈયે)
મઝીદ ફરમાયા : ને’મત પર ખુશ હોના અગર ફાયર, તકબુર ઔર
શૈખી કે તૌર પર હો તો બુરા હૈ ઔર તરીકાએ કુફફાર હૈ ઔર અગર
શુક કે લિયે હો તો બેહતર હૈ, તરીકાએ સાલિહીન હૈ.

صَلُّوٰ عَلَى الْحَبِيبِ ! صَلُّوٰ عَلَى مُحَمَّدٍ

માલ કે બારે મેં સુવાલ

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! દુન્યા કી હર આસાઈશ મેં
આજમાઈશ હૈ, કિયામત કે દિન ઈન આસાઈશોં (રાહતોં) ઔર
કશાઈશોં (યા’ની ફરાબિયોં) કે મુ-તઅલ્બિક સુવાલ હોના હૈ. જિસ
કો દુન્યા મેં જિતની જિયાદા ને’મતેં ઔર વસાઈલ હાસિલ હોંગે, ઉસ
કો આભિરત મેં ઉસી કદર મસાઈલ ભી દરપેશ હોંગે, જબ બરોજે
મહશર દુન્યવી માલ વ અસબાબ કે બારે મેં સુવાલાત હોંગે, માલ કે

કશમાનો મુખલાફા : ﴿كَذَلِكَ تَعْتَدُ اللَّهُ عَلَيْهِ وَالْمُجْرِمُونَ﴾ : જિસ કે પાસ મેં જિડ હો ઓર વોહ મુજ પર દુદ્દાં શરીરોન
પછે તો વોહ લોગોનો મેં સે કન્જૂસ તરીન શખ્સ હૈ.

(તરણીબ વ તરણીબ)

ગલત ઈસ્ટિ'માલ પર અલ્લાહ ઉર્વોહ ઈતાબ ફરમાએગા તો ગફલત શિઆર માલદાર કે સામને યેહ હકીકત ખુલ કર આ જાએગી કે
“મુજ જેસા દુન્યા કા અમીર આભિરત કા ફીર હૈ.” જેસા કે હજરતે
સથિદુના અબૂ ઝર જિફારી ﷺ કા બયાન હૈ કે સરદારે
મક્કાએ મુકર્રમા, સુલ્તાને મદીનાએ મુનવ્વરહ ને
ઈશાદ ફરમાયા : “જિયાદા માલ વાલે કિયામત કે દિન કમ સવાબ
વાલે હોંગે, મગર જિસે અલ્લાહ ઉર્વોહ માલ દે ઓર વોહ ઉસે દાંએ
બાંએ ઓર આગે પીછે દે ઓર ઉસ મેં નેક અમલ કરે.”

(صحيح بخاري ج ٤ ص ٢٣١ حديث ٦٤٤٣)

ને'મતોં કે બારે મેં પૂછુગાઇ હોગી

પારહ 30 સૂ-રતુતકાસુર કી આભિરી આયત મેં ઈશાદિ રજબે
અકબર ઉર્વોહ હૈ :

﴿وَسَلَّمَ لِلَّهِ مَنْ يَرِدُ إِلَيْهِ مِنْ أَنفُسِهِ وَمَنْ يُمْسِي إِلَيْهِ مِنْ أَنفُسِهِ فَإِنَّ اللَّهَ عَلَىٰ مَا يَعْمَلُونَ﴾

જરૂર ઉસ દિન તુમ સે ને'મતોં કી પુરસ્કાર હોગી.

દોગ્રખ કે કનારે ને'મતોં કે મુ-તાતાલિક સુવાલાત

મુફસ્સિરે શહીર, હકીમુલ ઉમ્મત મુફતી અહમદ યાર ખાન
ને “તફસીરે નૂરુલ ઈરફાન” મેં ઈસ આયતો
મુખા-રકા કે તથૃત કદરે તફસીલ કે સાથ કલામ ફરમાયા હૈ, ઈસ મેં
સે બા'જ બાતોં અર્જ કરને કી કોશિશ કરતા હું : “મૈદાને હશર યા
દોગ્રખ કે કનારે પર તુમ સે ફિરિશ્ટે યા ખુદ રબ તાલા ને'મતોં કે
મુ-તાતાલિક સુવાલ ફરમાએગા ઔર યેહ સુવાલ હર ને'મત કે
મુ-તાતાલિક હોગા, જિસમાની યા રૂહાની, જરૂરત કી હો યા ઐશ વ

હરમાળે મુખલફા : بَسْنَ اللَّهُ تَعَالَى عَلَيْهِ وَبَسْلَمَ : ઉસ શપણ્સ કી નાક ખાક આલૂદ હો જિસ કે પાસ મેરા જિડક
હો ઓર વોહ મુજ પર દુષ્ટે પાડ ન પઢે. (હાડિમ)

રાહત કી, હતાકે ઠન્ડે પાની, દરખ્ત કે સાએ, રાહત કી નીંદ કા ભી. મુફતી સાહિબ મજીદ ફરમાતે હું : બા'દે મૌત તીન વક્ત ઔર તીન જગાહ હિસાબ હોગા, (1) કબ્ર મેં ઈમાન કા (2) હશર મેં ઈમાન વ આ'માલ કા (3) દોઝખ કે કનારે ને'મતોં કે શુક કા. બિગેર દસ્તિધૂકાક જો અતા હો વોહ ને'મત હૈ, રબ કા હર અતિથ્યા ને'મત હૈ ખ્વાહ જિસમાની હો યા રૂહાની ઈસ કી દો કિસમેં હું (1) કસબી (2) વહ્દબી. કસબી યા'ની વોહ ને'મતે જો હમારી કમાઈ સે મિલેં, જેસે દૌલત, સલ્તાનત વગૈરા. વહ્દબી યા'ની વોહ ને'મતે જો મહૂજ રબ કી અતા સે હોં, જેસે હમારે આ'જા, ચાંદ, સૂરજ વગૈરા. કસબી (યા'ની અપની કોશિશોં સે હાસિલ કિયે હુએ માલ યા હુનર ઐસી) ને'મત કે મુ-તાલિક તીન સુવાલ હોંગે, (1) કહાં સે હાસિલ કીં ? (2) કહાં ખર્ચ કીં ? (3) ઈન કા કયા શુક્રિયા અદા કિયા ? વહ્દબી (યા'ની બિગેર હમારી કોશિશ કે મિલી હુઠી) ને'મતોં કે મુ-તાલિક આખિરી દો² સુવાલ હોંગે (યા'ની કહાં ખર્ચ કીં ? ઈન કા કયા શુક્રિયા અદા કિયા ?). તફસીરે ખાજિન, તફસીરે અજીજી, તફસીરે રૂહુલ બયાન વગૈરા મેં હૈ કે મજકૂરા આયતે કરીમા મેં "الْعَيْمٌ" સે નબિયે કરીમ કી જાતે વાલા સિફાત મુરાદ હૈ, હમ સે હુગ્લે અકરમ કે બારે મેં સુવાલ હોગા કે તુમ ને ઈન કી હતાઅત કી યા નહીં ? કયૂંકે હુગ્લે પુરનૂર, શાફેએ યૌમુન્નુશૂર તો તમામ ને'મતોં કી અસ્લ હૈન, આપ કી મહાયુત જિસ દિલ કો રોશન કર દે, ઉસ કે લિયે તમામ ને'મતેં રહમતેં હૈન ઔર બદ કિસમતી સે જિસ કે દિલ મેં

જ્ઞાનાનું મુખ્યવક્ષા : ﴿كَذَلِكَ تَعَالَى عَنِ الْمُوَسَّمِ﴾ : જીસ ને મુજ પર રોજ જુમુઆ દો સો ભાર હુદ્દે પાક પણ ઉસ કે દો સો સાલ કે ગુનાહ મુઆફ હોએ.

(કન્જુલ ઉમાલ)

રસૂલુલ્લાહُ ﷺ કી મહિષત ન હો ઉસ કે લિયે સબે
ને'મતેં જહમતેં હોએ, દૌલતે ઉસ્માની રહમત થી, દૌલતે અબૂ જહીલ જહમત."

સંદર્ભ પ્રારે કી હયા કા કે ન લે મુજ સે હિસાબ
બખ્શ બે પૂછે લજાએ કો લજાના કયા હૈ

(હદાઈક બાજીશા શરીફ)

صَلَوٰةٌ عَلَى الْحَبِيبِ ! صَلَوٰةٌ عَلَى مُحَمَّدٍ

કિયામત મેં માલદારોં કે હિસાબ કી લરજા ઐઝ કેફિયત

હલાલ માલ જમ્મ કરના બેશક ગુનાહ નહીં, નીજ દૌલત મન્દી કી વજહ સે કિસી માલદાર કો ગુનહગાર કહના રવા નહીં. અગાર 100 ફી સદી હલાલ માલ કે સબબ કોઈ માલદાર બના ઔર અલ્લાહ વ રસૂલ ﷺ કી ફરમાં બરદારી કરતે હુએ ઉસ ને અપના માલ ખર્ચ કિયા તો ગુનહગાર કુજા સવાબે દારેન કા હક્કદાર હૈ. લિધાજા માલ કમાના હી હૈ તો સિર્ફ વ સિર્ફ હલાલ તરીકે પર કમાના ચાહિયે. મગર સિર્ફ બ કદરે ઝરૂરત કમાને હી મેં આફિયત હૈ, કયૂંકે હલાલ માલ કા હિસાબ હોગા ઔર બરોજે કિયામત હિસાબ કી કિસી મેં તાબ ન હોયાં. હુજુજતુલ ઈસ્લામ હજરતે સાચ્છદાના ઈમામ મુહમ્મદ બિન મુહમ્મદ બિન મુહમ્મદ ગજાતી અધ્યાત્મિક ઉલૂમ કી તીસરી જિલ્લ મેં નકલ કરતે હૈને :

“કિયામત કે દિન એક શખ્સ કો લાયા જાએગા જિસ ને હરામ માલ કમાયા ઔર હરામ જગહ પર ખર્ચ કિયા, કહા જાએગા : ઈસે જહન્નમ કી તરફ લે જાઓ ઔર એક દૂસરે શખ્સ કો લાયા જાએગા જિસ ને હલાલ તરીકે સે માલ કમાયા ઔર હરામ જગહ પર ખર્ચ કિયા, કહા

કશમાળે મુખલફા : ﴿كَسْمَلَ اللَّهُ تَعَالَى مَلِيئَةُ الْوَسْطَمِ﴾
મુજ પર દુઃદ શરીફ પઠો અલ્લાહ ઉંગું તુમ પર રહમત
(ઈજને અદી)

જાએગા : ઈસે ભી જહન્નમ મેં લે જાઓ, ફિર એક તીસરે શાખ્સ કો
લાયા જાએગા જિસ ને હરામ ઝરાએએ સે માલ જમ્બ કર કે હલાલ
જગહ પર ખર્ચ કિયા, કહા જાએગા : ઈસે ભી જહન્નમ મેં લે જાઓ
ફિર (ચૌથે) એક ઔર શાખ્સ કો લાયા જાએગા જિસ ને હલાલ ઝરાએએ
સે કમા કર હલાલ જગહ પર ખર્ચ કિયા, ઉસ સે કહા જાએગા : ઠહર
જાઓ ! મુખ્ખિન હૈ તુમ ને ત-લબે માલ મેં કિસી ફર્જ મેં કોતાછી કી
છો, વક્ત પર નમાઝ ન પઢી છો, ઔર ઉસ કે રૂક્ષું વ સુજૂદ ઔર
વુજૂ મેં કોઈ કોતાછી કી છો ! વોહ કહેગા : યા અલ્લાહ ! મૈં ને
હલાલ તરીકે પર કમાયા ઔર જાઈજ મકામ પર ખર્ચ કિયા, ઔર
તેરે ફરાઈજ મેં સે કોઈ ફર્જ ભી જાએએ નહીં કિયા. કહા જાએગા :
મુખ્ખિન હૈ તૂને ઈસ માલ મેં તકબ્બુર સે કામ લિયા છો, સુવારી યા
લિબાસ કે ઝરીએ દૂસરોં પર ફખ્ર જાહિર કિયા છો ! વોહ અર્જ કરેગા :
એ મેરે રબ ! મૈં ને તકબ્બુર ભી નહીં કિયા ઔર ફખ્ર કા ઈજહાર ભી
નહીં કિયા. કહા જાએગા : મુખ્ખિન હૈ તૂને કિસી કા હક દબાયા છો
જિસ કી અદાએગી કા મૈં ને હુકમ દિયા હૈ કે અપને રિશ્ટેદારોં,
યતીમોં, ભિસ્કીનોં ઔર મુસાફિરોં કો ઉન કા હક દો ! વોહ કહેગા :
એ મેરે રબ ! મૈં ને ઐસા નહીં કિયા, મૈં ને હલાલ તરીકે પર કમાયા
ઔર જાઈજ મકામ પર ખર્ચ કિયા ઔર તેરે કિસી ફર્જ કો તર્ક નહીં
કિયા, તકબ્બુર વ ગુરુર ભી નહીં કિયા ઔર કિસી કા હક ભી જાએએ
નહીં કિયા, તૂને જિસે દેને કા હુકમ દિયા (મૈં ને ઉસે દિયા).

ફિર વોહ સબ લોગ આંદેંગે ઔર ઉસ સે ઝગડા કરેંગે, વોહ
કહેંગે : યા અલ્લાહ ! તૂને ઈસે માલ અતા કિયા ઔર માલદાર
બનાયા ઔર ઈસે હુકમ દિયા કે વોહ હમેં દે ઔર હમારી મદદ કરે.
અબ અગર ઉસ ને ઉન કો દિયા હોગા, ઔર ફરાઈજ મેં કોતાછી ભી
નહીં કી હોણી, તકબ્બુર ઔર ફખ્ર ભી નહીં કિયા હોગા ફિર ભી

કશમાને મુખતાજા : ﷺ : મુજ પર કસરત સ્વરૂપે પાડ પણ બશક તુભારા મુજ પર
કુરૂપે પાડ પછના તુભારે ગુનાહો કે લિયે ભગફિરત હૈ।
(જોણે સગી)

કહ જાએગા રૂક જા ! મૈને તુઝે જો ભી ને' મત ઈનાયત કી થી, ખ્વાહ
વોહ ખાના થા, પાની થા યા કોઈ સી ભી લજૂઝત, ઉન સબ કા શુક
અદા કર, ઈસી તરહ સુવાલ પર સુવાલ હોતા રહેગા。”

(احياء الفلوم ج ٣١ ص ٣٣١ دار صادر بيروت)

સુવાલ ઇસ સે હોગા જિસ ને હલાલ કર્માયા હોગા

યેહ રિવાયત નકલ કરને કે બા'દ સચ્ચિદુના ઈમામ ગજાલી
ને જો કુદુ ફરમાયા હૈ ઉસ કો અપને અન્દાજ મેં અર્જ કરને
કી સાચ્ચુય કરતા હું : મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! બતાઈયે ! ઈન
સુવાલાત કે જવાબાત દેને કે લિયે કૌન તથ્યાર હોગા ? સુવાલાત ઉસ
આદમી સે હોંગે જિસ ને હલાલ તરીકે પર કર્માયા હોગા નીજ તમામ
હુક્કુક ઓર ફરાઈજ ભી કર્મા હક્કુહૂ (મુક્ખલ તૌર પર) અદા કિયે
હોંગે. જબ ઐસે શાખસ સે યેહ હિસાબ હોગા તો હમ જૈસે લોગોં કા
ક્યા હાલ હોગા જો દુન્યવી ફિતનોં, શુભ્ષોં, નફસાની ખ્વાહિશોં,
આરાઈશોં ઓર જીનતોં મેં દૂબે હુએ હું ! ઈન સુવાલાત હી કે ખૌફ કે
બાઈસ અલ્લાહ કે નેક બન્દે દુન્યા ઓર ઈસ કે માલો મતાઅ
સે આલૂદા હોને સે ડરતે હું, વોહ ફક્ત ઝરૂરત કે મુતાબિક મુખ્તસર
સે માલે દુન્યા પર કનાઅત કરતે હું ઓર અપને માલ સે તરહ તરહ
કે અથ્યે કામ કરતે હું. હુજુજતુલ ઈસ્લામ હજરતે સચ્ચિદુના ઈમામ
મુહમ્મદ બિન મુહમ્મદ બિન મુહમ્મદ ગજાલી નેક બન્દો
કે કસરતે માલ સે બચને કી કેફિય્યત બધાન કરને કે બા'દ આમ
મુસલ્માનોં કો “નેકી કી દા'વત” દેતે હુએ ફરમાતે હું : આપ કો ઉન
નેક લોગોં કે તરીકે કો ઈખ્તિયાર કરના ચાહ્યે, અગર ઈસ બાત કો

કરમાને ગુણવાના : ﷺ : જો મજૂર પર એક દુક્કદ શરીરોફ પહ્તા હે અલ્લાહ ઉર્જુખું ઉર્સ કે લિયે એક કીરત આજ લિખતા હૈ ઔર કીરત ઉર્દુદ પહાડ જિતતા હૈ. (આધુનિકશાસ્ત્ર)

આપ ઈસ લિયે તરસીમ નહીં કરતે કે આપ અપને ખ્યાલ મેં પરહેઝ ગાર ઔર નિહાયત હી મોહતાત હૈનું ઔર સિઝી હલાલ માલ કમાતે હૈનું ઔર કમાને સે મકસૂદ ભી મોહતાજ ઔર સુવાલ સે બચના ઔર રાહે ખુદા મેં ખર્ચ કરના હૈ ઔર આપ કા જેણું યેહ બના હુવા હૈ કે મેં અપના હલાલ માલ ન તો ગુનાહોં મેં સર્જ કરતા હું ન હી ઈસ સે કુજૂલ ખર્ચી કરતા હું નીજ માલ કી વજહ સે મેરા દિલ અલ્લાહ ઉર્જુખું કે પસન્દીદા રાસ્તે સે ભી નહીં બદલતા ઔર અલ્લાહ ઉર્જુખું મેરે કિસી જાહિર ઔર પોશીદા અમલ સે નારાજ ભી નહીં હૈ, અગર્યે ઐસા હોના ના મુદ્દિન હૈ. બિલફર્જ ઐસા હો તથ ભી આપ કો ચાહિયે કે સિઝી ઝરૂરત કે મુતાબિક માલ પર હી રાજી રહેં ઔર માલદારોં સે અલાહિદગી ઈજિયાર કરેં, ઈસ કા સબ સે બડા ફાઅદા યેહ હોગા કે જબ ઉન માલદારોં કો કિયામત મેં હિસાબ કે લિયે રોકા જાએગા તો આપ પહલે હી કાફિલે કે સાથ સારવરે કાયેનાત કે બા'દ નજીત હોગી યા સખ્તી. હમેં યેહ બાત પહોંચી હૈ કે નબિયે અકરમ, નૂરે મુજસ્સમ, શાહે બની આદમ, નબિયે મુહૂતશામ, શાહેએ ઉમમ (તરુણી હેઠાળ) : “કુ-કરા મુહાજિરીન, માલદાર મુહાજિરીન સે પાંચ સો સાલ પહલે જન્મત મેં જાઓંગો.” (૨૨૦૮) (માહૂર અધ્યાત્મી ગ્રંથ ૩૨૨ પૃષ્ઠા)

મુજ કો હુન્યા કી દૌલત ન જર ચાહિયે
શાહે કૌસર કી મીઠી નજર ચાહિયે
صَلُّو عَلَى الْحَبِيبِ ! صَلُّوا عَلَى مُحَمَّدٍ

કશગાંબે મુખવકા : سَلَّمَ اللَّهُ تَعَالَى عَلَيْهِ وَالْهُوَ سَلَّمَ : જિસ ને હિતાબ મેં મુજ પર દૂર્દુષે પાક લિખા તો જબ તક મેરા નામ ઉસ મેં રહેગા હિરિશે ઉસ કે લિખે ઈસ્તિગ્ફાર કરતે રહેગે. (ત-બસાની)

માલ કા ઈસ્તિ'માલ ઓર ઉખરવી વબાલ

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! દુન્યવી ને 'મતો ઔર રાહતોં સે માલામાલ લોગોં કો માલ કે ઈસ્તિ'માલ કે વકત ખબરદાર રહેના ચાહિયે કે ઈસ કે ગલત ઈસ્તિ'માલ કા અન્જામ ઉખરવી વબાલ હૈ, યુંધી માલો દૌલત કી બે જા મહબ્બત ગુનાહોં પર ઉક્સાતી, દર બદર ફિરાતી, લૂટમાર કરવાતી હતાકે લાશોં જિરવાતી હૈ ઔર જબ યેહ દૌલત કિસી મુહિબ્બે માલ કે હાથ સે નિકલને પર આતી હૈ તો બેહદ સતાતી ઔર ખૂબ તડપાતી ઔર રૂલાતી હૈ, લિહાજા હમારે બુઝુગને દીન માલો દૌલત કે મુઆ-મલે મેં નિહાયત હી મોહતાત થે. ચુનાન્યે હજરતે સાચ્છિદુના અબુદરદા رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ وَالْهُوَ سَلَّمَ ને હજરતે સાચ્છિદુના સલમાન ફારસી رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ وَالْهُوَ سَلَّمَ કો એક મકતૂબ રવાના ફરમાયા જિસ મેં થા : એ મેરે ભાઈ ! દુન્યા સે ઈતના કુછ જમ્બાન કરો કે હક્કે શું અદા ન કર સકો, મૈં ને અમ્બિયા કે તાજદાર, શહનશાહે અભરાર, દો² આલમ કે માલિકો મુખ્તાર કો ફરમાતે સુના હૈ કે બરોજે કિયામત એક એસે માલદાર શખ્સ કો લાયા જાએગા જિસ ને અલ્લાહ عَزَّوَجَلَّ કી ફરમાં બરદારી મેં જિન્દગી બસર કી હોગી, પુલ સિરાત પાર કરતે હુએ ઉસ કા માલ ઉસ કે સામને હોગા, જબ વોહ લડ ખડાને લગેગા તો ઉસ કા માલ કહેગા : “ચલતે જાઓ ! કયુંકે તુમ ને મુજ સે મુ-તઅલિક અલ્લાહ તાલાલા કા હક અદા કર દિયા હૈ.” ફિર એક ઔર માલદાર કો લાયા જાએગા, જિસ ને દુન્યા મેં અપને માલ મેં સે અલ્લાહ તાલાલા કા હક અદા નહીં કિયા હોગા, ઉસ કા માલ ઉસ કે દોનોં કન્ધોં કે દરમિયાન હોગા, વોહ શખ્સ જબ પુલ સિરાત પર લડ-ખડાએગા તો ઉસ કા માલ ઉસ સે કહેગા : તૂ બરબાદ હો !

કશમાનો મુખ્યતવા : કુલ અંદર તાલુકા, બાર એક બાર હૃદિને પાક પણ અલ્લાહ હું જીલ
ઉસ પર દસ રહેતો લેજતા હૈ.

(મુખ્યિતબ)

તુને મુઝ સે અલ્લાહ તાલા કા હક કર્યું અદા નહીં કિયા ? પસ
વોહ ઈસી તરહ હલાકત વ બરબાઈ કો પુકારતા રહેગા.

(તારિખ યેષ્ણ લાભ ઉસ્કાર જ ١٥٢ ص ٤٧) دارالفکر بیروت

તેરી તાકત, તેરા ફન ઓહદા તેરા	કુછ ન કામ આચેગા સરમાયા તેરા
દબદબા હુન્યા હી મેં રહ જાએગા	ઝોર તેરા ખાક મેં મિલ જાએગા
અતને હુન્યા સિકન્ડર થા ચલા	જબ ગયા હુન્યા સે ખાલી હાથ થા

(વસાઈલે બજીશા, સ. 375, 376)

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! બયાન કર્દી રિવાયત મેં ઈબ્રત
હૈ ઉન સાહિબાને સરવત વ હેસિયત કે લિયે જો ફર્જ હોને કે બા
વુજૂદ ઝકાત દેને સે કતરાતે, અપની દૌલત કો ગુનાહોં કે કામોં મેં
ગંવાતે, ભલાઈ કે કામોં મેં ખર્ચ કરને સે જી ચુરાતે ઔર મોહતાજોં કી
મદદ સે જાન છુડાતે હૈં. ગૌર ફરમા લીજિયે કે આજ ખુશ હાલ કર
દેને વાલા માલ બરોજે કિયામત વબાલ કી સૂરત ઈજિયાર કર ગયા
તો હમારા ક્યા બનેગા ? કાશ ! હમારે હિલોં સે હુન્યા વ માલે હુન્યા
કી બે જા મહિષત નિકલ જાએ ઔર હમારી કંબો આખિરત બેહતર
હો જાએ.

મેરે હિલ સે હુન્યા કી ઉલ્ફત મિટા દે મુજે અપના આશિક બના યા ઈલાહી !
તુ અપની વિવાયત કી ખેરાત દે દે મેરે ગૌસ કા વાસિતા યા ઈલાહી !

મ-દની ઈન્દ્રામાત મેં અસ્લાફ કી યાદ

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! બયાન કર્દી રિવાયતે મુખા-રકા
સે યેહ ભી પતા ચલા કે અપને ઈસ્લામી ભાઈયોં કો મકતૂબાત કે
જરીએ નેકી કી દા'વત પેશ કરના સહાબે કિરામ عَلَيْهِمُ الرَّحْمَةُ કી
સુન્તતે કરીમા હૈ. جَلَّ جَمَدَ اللَّهُ عَزَّ وَجَلَّ! તરબીગે કુરાનો સુન્તત કી
આલમગીર ગૈર સિયાસી તહરીક દા'વતે ઈસ્લામી દીગર મ-દની
ખૂબિયોં કી હામિલ હોને કે સાથ સાથ અસ્લાફ કિરામ رَحْمَةُ اللَّهِ إِلَيْهَا سَلَامٌ કી

ફરમાવે મુખ્યત્વાઃ : ﴿كُلَّ أَنْذِلَ اللَّهُ تَعَالَى عَلَيْهِ وَالْمُوْسَلِمُونَ﴾ જનતા કા રસ્તા ભૂલ ગયા.

(ત-બારાની)

યાદ ભી તાજા કરતી હૈ જૈસા કે નેકી કી દા'વત પર મુશ્તમિલ મ-દની મક્તુબાત રવાના કરના. ઈસ કી તરણીબ દિલાતે હુએ દા'વતે ઈસ્લામી કે ઈન્નામાત મેં સે મ-દની ઈન્નામ નમ્બર 57 હૈ : {“ક્યા આપ ને ઈસ હફ્તે કમ અઝ કમ એક ઈસ્લામી ભાઈ કો મક્તુબ રવાના ફરમાયા ?”} (મક્તુબ મેં મ-દની ઈન્નામાત ઔર મ-દની કાફિલે કી તરણીબ દિલાએ) આપ સે ભી મ-દની ઈલ્લિજ હૈ કે “દા'વતે ઈસ્લામી” કે મ-દની માહોલ સે તા દમે હયાત મુન્સલિક રહિયે, “મ-દની ઈન્નામાત” કે મુતાબિક અમલ કી કોશિશ કીજિયે, إِنَّ شَأْدَةَ اللَّهِ عَزَّ وَجَلَّ بُرُوجُهُمُ اللَّهُمَّ اللَّهُمَّ બુજુગાને દીન કુયૂમાત ઔર હુન્યા વ આભિરત કી કસીર બ-રકાત હાસિલ હોંગી ઔર કસરતે દૌલત કી હવસ કે બજાએ નેકિયોં કી કસરત કી હિર્સ બઢેગી.

દે જગ્યા “મ-દની ઈન્નામાત” કા તૂ કરમ બહરે શહે કબો'બલા હો
કરમ હો દા'વતે ઈસ્લામી પર યેહ શરીક ઈસ મેં હર ઈક છોટા બડા હો

(વસાઈલે બાળિશા, સ. 91)

امين بجاہ الٰیٰ الْمَمِنَ صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَالْهُوَ أَكْبَرُ

ધન કમાને કી ધુન

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! આજ હમારે મુઆશરે મેં અકસર લોગોં કે જેહુનોં પર દૌલતોં ઔર ખજાને કે અમ્બાર જમ્બ કરને કી ધુન સુવાર હૈ ઔર ઈસ રાહે પુરખાર મેં ખ્વાહ કિતની હી તકાલીફ સે દો ચાર હોના પડે, પરવાહ નહીં, બસ ! હર વક્ત દૌલતે હુન્યા જમ્બ કરને કી હિર્સ હૈ, અગર કભી આભિરત કી ભલાઈ કે લિયે નેકિયોં કી દૌલત ઈકણી કરને કી તરફ તવજ્જોહ દિલાઈ ભી જાએ તો

જ્રસ્તાનો મુશ્કેલ કા : જિસ કે પાસ મેરા જિક હુવા આં ર ઉસ ને મુજ પર દુઃખ પાક
ન પછા તહીંક વોહ બદબાધ હો ગયા। (ઈથે ચુણી)

મુલા-જમત યા કારોબારી મસરૂફિયત વગૈરા કે બહાને આડે આ
જાતે હું, બાલ બચ્ચોં કા હુન્યવી મુસ્તકિબલ સંવારને કી કોશિશોં મેં
અપના ઉખરવી મુસ્તકિબલ ભૂલ જાતે હું, ઔલાદ કી હુન્યવી પઢાઈ
ફિર ઉન કી શાદી કી ફિક કિસી ઓર તરફ જેણું જાને હી નહીં દેતી.
ઔલાદ કે હુન્યવી મુસ્તકિબલ કી બેઢતરી કે લિયે હમારે બુજુગનીને
દીન રَحْمَهُ اللَّهُ عَلَيْهِ وَرَحْمَةُ اللَّهِ عَلَيْهِ وَبَرَّهُ اللَّهُ عَلَيْهِ
કા કેસા મ-દની જેણું થા ! યેહ ભી મુલા-હજા
ફરમાઈયે ચુનાન્યે

ઉમર બિન અબ્ડુલ અઝીઝ કી મ-દની સોચ

દા'વતે ઈસ્લામી કે ઈશાઅતી ઈદારે મક-ત-બતુલ મદીના કી
મતબૂઝા 415 સર્ફહાત પર મુશ્તમિલ કિતાબ “જિયાએ સ-દક્કત”
સર્ફહા 83 પર હૈ કે હજરતે સાચિદુના મસ્લિમહ બિન અબ્ડુલ મલિક
હજરતે સાચિદુના ઉમર બિન અબ્ડુલ અઝીઝ કી આહિરી હ્યાત કે આખિરી લમ્હાત મેં હાજિર હુએ
ઓર કહા : એ અમીરુલ મુઅમિનીન ! આપ
ને રષીલુલ ઉદ્દેશુની નામાર કર હુન્યા સે તશરીફ લે
જા રહે હું, આપ કે 13 બચ્ચે હું લેકિન વિરાસત મેં ઉન
કે લિયે કોઈ માલ વ અસભાબ નહીં છોડા ! યેહ સુન કર હજરતે
સાચિદુના ઉમર બિન અબ્ડુલ અઝીઝ ને ઈશ્વરીં ફરમાયા :
મૈં ને અપની ઔલાદ કા હક રોકા નહીં ઓર દૂસરોં કા ઈન કો દિયા
નહીં ઓર મેરી ઔલાદ કી દો હાલતેં હું અગર વોહ અલ્લાહ
કી ઈતાઅત કરેંગે તો વોહ ઉન કો કિફાયત ફરમાએગા ક્યુંકે અલ્લાહ
નેક લોગોં કો કિફાયત ફરમાતા હૈ ઓર અગર મેરી ઔલાદ
ના ફરમાન હુએ તો મુઝે ઈસ બાત કી પરવાહ નહીં કે મેરે બા'દ

જ્ઞાનાને મુખથાં : જિસ ને મુજ પર દસ મરતબા સુણ આર દસ મરતબા
શામ દુઃદોપાકયથા ઉસે કિયામત કે હિન મેરી શક્ષાત્ત મિલેગી। (મજમ'ઉન્જવાઈદ)

માલી એ'તિબાર સે ઉન કી ત્રિન્દગી કેસે ગુજરેગી। (احياء الفلوج ص ٢٨٨)

અલ્હાનું કી ઉન પર રહમત હો ઔર ઉન કે સદકે હમારી બેહિસાબ મણિકરત હો.

أَمِين بِحَمَادَةِ النَّبِيِّ الْأَكْمِينِ صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَسَلَّمَ

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! યહાં યેહ યાદ રહે કે અગાર
કિસી કે પાસ માલ હૈ તો ઉસે યેહી હુકમ હૈ કે સ-દકા કરને કે બજાએ
ઓલાદ કી ઝરૂરત કે લિયે રખ છોડે.

મેરે ગૌસ કા વસીલા રહે શાદ સબ કબીલા

ઇન્હેં ખુલ્દ મેં બસાના મ-દની મદીને વાલે

(વસાઈલે બાજીશા, સ. 160)

صَلُوَاعَلَى الْحَيْبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ આજમાઈશ મેં કામ્યાબી કી સૂરત

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! બિલા હાજત દુન્યવી માલો દૌલત
જમ્બ કરને કા જાબા કાબિલે તા'રીફ નહીં ઔર જિસે અલ્હાનું
ને બ કસરત દુન્યવી દૌલત ઈનાયત ફરમાઈ હો ઉસ કે લિયે
કામ્યાબી કી સૂરત યેહી હૈ કે વોહ ઉસ કો **અલ્હાનું** વ રસૂલ
કી ઈતાઅત કે મુતાબિક ખર્ચ કર કે નેકિયોં
કી દૌલત મેં ઈજાફા કરે ચુનાન્યે દા'વતે ઈસ્લામી કે ઈશાઅતી ઈદારે
મક-ત-બતુલ મદીના કી મતબૂઆ 417 સફહાત પર મુશ્તમિલ મુન્હરિદ
કિતાબ “લુબાબુલ એહ્યા” સફહા 258 પર હૈ : હજરતે સચ્ચિદુના
ઈસા રૂહુલ્લાહ ને ઈશાંદ ફરમાયા : “દુન્યા કો
આકાન બનાઓ વરના વોહ તુમ્હેં ગુલામ બના લેગી, અપના માલ

કરમાને ગુણવાનું : ﷺ : જિસ કે પાસ મેરા છિક હુવા ઓર ઉસ ને મુજ પર દુકું
શરીફ ન પઢા ઉસ ને જફા ઈ.

(અભૂતિશ્રાદ)

ઉસ જાત કે પાસ જમ્મા કરો જિસ કે પાસ સે ઝાએએ નહીં હોતા કયુંકે
જિસ કે પાસ દુન્યા કા ખજાના હો ઉસે (ચોરી હોને યા છિન જાને
વગેરા કી) આફિત કા ડર હોતા હૈ, લેકિન (સ-દકા વ બૈરાત કર કે)
આલ્લાહુ કે પાસ અપના માલ જમ્મા કરાને વાલે કો કિસી
કિસમ કા ખતરા નહીં હોતા.”

(لُبَابُ الْإِحْيَا (عربى) ص ٢٣١ ماخوذًا دارالبيروتى دمشق)

તેરે ગમ મેં કાશ અતાર, રહે હર ઘડી ગરિફતાર
ગમે માલ સે બચાના, મ-દની મદીને વાલે
صَلُّوَاعَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

આફિત સે નજીત કા ઝરીઆ

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો! અભી આપ ને મુલા-હજા ફરમાયા
કે ખાલિકે કાયેનાત, **આલ્લાહુ** રખ્ખુલ અર્જે વસ્સમાવાત ઉર્વોહુલ કી રાહ
મેં સ-દકા વ બૈરાત કરના બેહદ ફાયેદે કા સૌદા હૈ ઔર ઈસ સે માલ
મહુકૂજ હો જતા હૈ. પડીનન સ-દકા વ બૈરાત આફિત સે નજીત કા
ઝરીઆ હૈ, લિલાજા હર એક કો ચાહિયે કે અપને માલ સે હરબે તૌકીક વ
વુસાત સ-દકા વ બૈરાત કરને કી સાઓદત હાસિલ કરતે રહિયે
બહુત સારી આફિતો ઔર મુસીબતો સે હિફાજત હોળી.
ચુનાન્યે દા'વતે ઈસ્લામી કે ઈશાઅતી ઈદારે મક-ત-બતુલ મદીના કા
મતબૂઝા રિસાલા “રાહે ખુદા મેં ખર્ચ કરને કે ફાઈલ” મેં આ'લા હજરત,
ઈમામે અહલે સુન્નત નકલ કરતે હોયાં :
الصَّدَقَةُ تَمْنَعُ سَعْيَنَ نَوْعًا مِنْ أَنْوَاعِ الْبَلَاءِ أَهْوَنُهَا الْجَذَامُ وَالْبَرَصُ

હશમાને મુખતાજ : ﷺ : જો મુઝ પર રોજ જુમુઆ દુર્દશ શરીફ પણું મેળે ડિયામત કે દિન ઉસ કી શક્યાત કરેંગા।

(કન્જુલ અમાર)

યા'ની સ-દકા 70 કિસ્મ કી બલાઓં કો રોકતા હૈ જીન મેં આસાન તરે બલા બદન કા બિગડના (કોઠ) ઔર સફેદ દાગ હૈને.”

(તારિખ બગદાર ચ ٤٠٠ دار الكتب العلمية بيروت)

લુકમે કે બદલે લુકમા

سُبْحَنَ اللَّهِ عَزَّوَ جَلَّ ! સ-દકા વાકેઈ બલાઓં કો દ્રુત કરતા હૈ. ઈસ કિસ્મ મેં એક ઈમાન અફરોજ છિકાયત સમાયત ફરમાઈયે ચુનાન્યે હજરતે સાચિદુના અભુલ્લાહ બિન અસ્થાદ યાફેઈ “રૌજુરિયાહીન” મેં નકલ ફરમાતે હૈને : અલ્લાહ કી ઊર્જોહી રિઝા કે લિયે એક ઔરત ને કિસી મોહતાજ (યા'ની મિસ્કીન) કો ખાના દિયા ઔર ફિર અપને શોહર કો ખાના પહોંચાને ઘેત કી તરફ ચલ પડી, ઉસ કે સાથ ઉસ કા બગ્યા ભી થા, રાસ્તે મેં એક દરિન્દે (યા'ની ફાડ ખાને વાલે જાનવર) ને બગ્યે પર હમ્લા કર દિયા, વોહ દરિન્દા બગ્યે કો નિગલના હી ચાહતા થા કે ના ગહાં (યા'ની અચાનક) ગૈબ સે એક હાથ ઝાહિર હુવા જિસ ને ઉસ દરિન્દે કો એક ઝોરદાર ઝર્બ લગાઈ ઔર બગ્યે કો છુડા લિયા, ફિર ગૈબ સે આવાજ આઈ : “ઔ નેક બખ્ત ! અપને બગ્યે કી સલામતી કે સાથ લે જા ! હમ ને લુકમે કે બદલે તુઝે લુકમા અતા કર દિયા.” (યા'ની તૂને ગરીબ કો ખાને કા લુકમા ખિલાયા તો અલ્લાહ ઊર્જોહી ને તેરે બગ્યે કો દરિન્દે કા લુકમા બનને સે બગા લિયા).

(રૂચ રીયાધીન ચ ٢٧٤)

અલ્લાહ કી ઉન પર રહમત હો ઔર ઉન કે સદકે હમારી બે છિસાબ મળિકરત હો.

أَوْبِينْ بِجَاهِ النَّبِيِّ الْأَمِينِ صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَسَلَّمَ

રહે હક મેં સભી દૌલત લુટા દૂં

ખુદા ! ઐસા મુઝે જગબા અતા હો

(વસાઈલે બાંધિશા, સ. 91)

કુશમાને મુખલકા : كُلَّ اللَّهُ تَعَالَى عَلَيْهِ وَسَلَّمَ : مુજ પર દુષ્કૃતે પાક કી કસરત કરો બેશક યેથે તુમ્હારે
લિયે તહારત હૈ. (અનૂચુ લા)

શૈતાન કા ગુલામ કૌન ?

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! જિસે માલે દુન્યા મિલને કે સાથ
સાથ રાહે ખુદા મેં ખર્ચ કરને કા જગ્ઝબા ભી મિલ ગયા વોહ તો
સાથાડત મન્દ ઠહરા લેકિન જો ગફલત મેં ડાલને વાલી દુન્યવી
આસાઈશોં મેં મુન્હમિક રહા ઔર નફસાની ખ્વાહિશાત કી પૈરવી
કી, ઉસ ને ગોયા શૈતાન કી ગુલામી ઈજિત્યાર કી જૈસા કે હુજજતુલ
ઈસ્લામ હજરતે સાચ્છિદુના ઈમામ મુહમ્મદ બિન મુહમ્મદ બિન મુહમ્મદ
ગાજાલી અહ્યાઉલ ઉલ્ઘૂમ મેં નકલ કરતે હૈને : જબ સબ સે
પહોંચે દિરહમ વ દીનાર તથાર હુએ તો શૈતાન ને ઉન કો ઉઠા કર
અપની પેશાની પર રખા ફિર ઉન કો ચૂમા ઔર બોલા : જિસ ને તુમ
સે મહિષત કી હકીકત મેં વોહ મેરા ગુલામ હૈ. (احياء العلوم ج ٣ ص ٢٨٨)

.....વોહ જલીલો ખ્વાર હો

રَحْمَةُ اللَّهِ الْبَيْنِ
મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! હમારે બુજુગાની દીન દુન્યવી માલો દૌલત ઔર ઈસ કી ફિક સે આજાદ ઔર તવક્કુલ વ
કનાઅત કી દૌલત સે માલામાલ થે, દુન્યવી મુસ્તકિબલ સે બઢ કર
ઉખરવી મુસ્તકિબલ કી ફિક મેં મળન રહેને વાલે સાથાડત મન્દ થે,
વોહ ઈસ હકીકત સે અચ્છી તરફ વાકિફ થે કે દૌલત કી મહિષત
બાઈસે રૂસ્વાઈ વ જિલ્લત હૈ, જૈસા કે મશહૂર વ મકબૂલ વલિયુલ્લાહ
હજરતે સાચ્છિદુના શૈખ શિબલી અલી ઉલ કા ઈશાદ હકીકત બુન્યાદ
હૈ : જિસ ને દૌલતે દુન્યા કે સાથ ખ્વાર કિયા વોહ જલીલો ખ્વાર હુવા.

(رَوْضَ الرَّيَاحِينَ ص ١٣٩ دار الكتب العلمية بيروت)

મેરા દિલ પાક હો સરકાર દુન્યા કી મહિષત સે
મુજે હો જાએ નફરત કાશ ! આકા માલો દૌલત સે

(વસાઈલે બાણિશ, સ. 133)

ફરગાને મુખતકા: ﴿تَعَالَى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: تُوْمَ جَاهِنْ بી હો મુજ પર દુર્દુદ પણો કે તુમહારા દુર્દુદ મુજ
તાક પહોંચતા હૈ.﴾
(ત-બસાની)

મહબ્બતે માલો દૌલત કી તબાહ કારિયાં

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! વાકેઈ માલો દૌલત કી મહબ્બત ઈન્સાન કો ખ્વારી વ જિલ્લત કે અમીક (યા'ની ગહરે) ગઢે મેં ધકેલ દેતી હૈ, અગર્યે બા'જ અવકાત ઈન્સાન દુન્યા મેં થોડી બહુત ઈજ્ઝાત વ શોહરત હાસિલ કર ભી લેતા હૈ મગર અક્સર ઉખરવી તબાહી વ બરબાદી ઉસ કા મુકદર બન જાતી હૈ. દૌલત કે નશે મેં મસ્ત રહને વાલોં કે લિયે હજરતે સાચ્છિદુના શૈખ શિબલી عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْأَكْبَرِ કે બયાન કર્દા ઈશાદ મેં ઈબ્રત હી ઈબ્રત હૈ. માલો દૌલત કી મહબ્બત મેં અન્યા હોને વાલા અન્જામે આભિરત સે બિલકુલ ગાંધીલ હો કર અહકામે શરીઅત કો પસે પુશ્ત ડાલ દેતા હૈ ફિર ઉસે હુકમે ખુદા عَزَّوَجَلَّ કી પરવાહ રહતી હૈ, ન હી ઈશાદ મુસ્તાફા صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ કા પાસ. યકીનન ફિકે માલો દૌલત ફિક આભિરત સે ગફલત મેં ડાલતી ઔર બે શુમાર ગુનાહોં કા સબબ બનતી હૈ જિન મેં સે ચન્દ યેહ હૈન : તર્કે ઝકાત વ ઉશર, સૂદ વ રિશવત કા લૈન હૈન, બુખલ કી નુહૂસત, કત્યે રેહૂભી (યા'ની રિશ્તેદારી તોડના) ઝૂટ ઔર નાહક દૂસરોં કા માલ દબા લેના વગૈરા.

માલ કી દીની વ દુન્યવી આફાત

દા'વતે ઈસ્લામી કે ઈશાઅતી ઈદારે મક-ત-બતુલ મદીના કી મત્બૂઆ 853 સર્ફાત પર મુશ્તમિલ કિતાબ “જહન્મ મેં લે જાને વાલે આ'માલ” જિલ્દ 1 સર્ફા 565 તા 567 પર શૈખુલ ઈસ્લામ, શહાબુદ્દીન ઈમામ અહમદ બિન હજર મક્કી શાહેઈ عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الرَّقِيْبِ ને માલો દૌલત કી આફાત તફસીલન બયાન ફરમાઈ હૈન, ઉન મેં સે ચન્દ કા જિક કરતા હું :

હરમાણે મુખવજા : ﴿كُنْ أَنْتَ تَعْلَمُ بِهِ دَوْلَمٌ﴾ : જિસ ને મુજ પર દસ મર્ત્યા દુષ્કણ પાક પણ આલ્લાહ હું
ઉસ પર સો રહ્મતોં નાભિલ ફરમાતા હૈ (ત-બરાણી)

દીની આઝાત

માલો દૌલત કી કસરત ઈન્સાન કો ગુનાહોં પર ઉભારતી ઔર પહોંચે મુખાહ (યા'ની જાઈજ) લજ્જાત કી તરફ લે જાતી હૈ હતાકે વોહ ઉન કા ઈસ કદર આદી હો જાતા હૈ કે ઉસ કે લિયે ઉન્હેં છોડના ઈન્ટિષાઈ મુશ્કિલ હો જાતા હૈ યહાં તક કે અગર વોહ હલાલ કમાઈ કે જરીએ ઉન્હેં હાસિલ ન કર સકે તો બસા અવકાત હરામ કામ કરને લગતા હૈ, ક્યૂંકે જિસ કે પાસ માલ કસરત સે હો, ઉસે લોગોં સે મેલજોલ ઔર તઅલ્લુકાત બઢાને કી ભી જિયાદા ઝરૂરત હોતી હૈ ઔર જો ઈસ ચીજ મેં મુખ્યલા હો જાએ વોહ ઉમ્મુમન લોગોં સે મુના-ફકત સે પેશ આએગા ઔર ઉન્હેં રાજી યા નારાજ કરને કે મુઆ-મલે મેં આલ્લાહ હું કી ના ફરમાની કા મુર-તકિબ હોગા તો ઈસ કે નતીજે મેં વોહ અદાવત, કીના, હસદ, રિયાકારી, તકષ્ણુર, જૂટ, ગીબત, ચુગલી વગેરા કા બાઈસ બનને વાલે દીગર કઈ બેઠે બેઠે ગુનાહોં મેં મુખ્યલા હો જાએગા.

દુન્યવી આઝાત

માલદારોં કો લાહિક હોને વાલી દુન્યવી આઝાત મેં ખૌફ વગમ, પરેશાની, મસાઈબ કા સામના, અમારત (યા'ની માલદારી) બર કરાર રખને કે લિયે હર દમ માલ કમાના ઔર ઉસ કી છેફાજત કરના વગેરા દીગર કઈ આઝાત શામિલ હૈન.

કરમાનો ગુલામ હલાક હો : જિસ કે પાસ મરા છે કુઝ આંદોલન પર દુષ્કાણ શરીર ન
પઢે તો વોહ લોગોનો મેં એ કન્જૂસ તરીન શખ્સ હૈ.

(તરગીબ વ તરહીબ)

માલ કા ગુલામ હલાક હો

ઈમામ ઈબને હજર ફરમાતે હૈને : માલ ન તો મુત્લકન ખેર (યા'ની ભલાઈ કી ચીજ) હૈ ન હી મહૂઝ શર (યા'ની બુરાઈ કી શૈ) માલ બા'જ અવકાત કાબિલે તા'રીફ હોતા હૈ ઔર કબી કાબિલે મજબૂત. લિહાજા જિસ ને કિફાયત (જરૂરત) સે જિયાદા હિસ્સા હાસિલ કિયા ગોયા ખુદ કો હલાકત પર પેશ કિયા, ક્યુંકે તથીઅતે હિદાયત સે રોકને વાલી હૈને ઔર શહીવાત વ ખ્વાહિશાત કી તરફ માઈલ રહતી હૈને ઔર માલ ઉન મેં આવે કા કામ દેતા હૈ. તો એસી સૂરત મેં જરૂરત સે ઝાઈદ માલ મેં સખત ખતરાત હૈને. મજીદ આગે ચલ કર આપ રહીએ ને હદ્ડીસે પાક નકલ કી હૈ કે શરીએ રોજે શુમાર, દો આલમ કે માલિકો મુખ્તાર, હબીબે પરવર્દ ગાર હિદ્રહમ વ દીનાર કા ગુલામ હલાક હો.”

(سنن ابن ماجه ج ٤ ص ٤٤١ حدیث ١٣٦ دارالعرفة بیروت)

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! કાશ હમ પર અલ્લાહ ઉંગુંજ ખુસૂસી રહમત કા નુજૂલ હો કે હમ દૌલતે હુન્યા સે ઘાર કરને ઔર ઈસી સોચ બિચાર મેં ગુમ રહને કે બજાએ ઉખરવી સાદતોં કી તરફ ધ્યાન દેને વાલે બન જાએં ઔર યેહ ઈસ્તિગાસા (યા'ની ફરિયાદ) હમારે હક મેં દ-ર-જએ કબૂલિયત કા શરફ પા લે :

કલીલ રોજી પે દો કનાઅત	હુન્યુલ ગોઈ સો દે દો નફરત
કુરૂદ પઢને કી બસ હો આદત	નબિયે રહમત, શરીએ ઉમત

(વસાઈલે બાણીશ, સ. 106)

صَلُّوٰ عَلَى الْحَبِيبِ ! صَلُّى اللّٰهُ تَعَالٰى عَلٰى مُحَمَّدٍ

હસ્તમાને મુખ્યતાકા : ﴿كَذَّلِ اللَّهُ تَعَالَى سَيِّدُ الْوَسْطَمُ﴾ : ઉસ શાખસ કી નાક ખાક આલૂદ હો જિસ કે પાસ મરા નિક હો ઓં વોં શુજ પર દુઃખે પાક ન પછે. (હાડિમ)

આગર આપ સુધરના ચાહતે હોં તો.....

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! આપ સે મ-દની ઈલિજા હે કે દા'વતે ઈસ્લામી કા મ-દની માહોલ અપના લીજિયે કે યેહ માહોલ ખજાનોં કા અમ્ભાર ઈકઢે કરને કે બજાએ અ-બદી સાચાદોં કા હકદાર બનને કા જેહુન દેતા હૈ, લિહાજા અગર આપ સુધરના ચાહતે હોં તો દિલ સે દુન્યા કી બે જા મહિષબત નિકાલને, રિજાએ ઈલાહી ઈન્દ્રાહાસિલ કરને કી તડપ કલ્બ મેં ડાલને, સીના સુન્તતે મુસ્તફા ચાલું કા મદીના બનાને, માલો દૌલત કો સહીહ મસરફ (યાંની ખર્ચ કી દુરુસ્ત જગત) મેં ઈસ્તિ'માલ કરને કા ઈલમ પાને ઔર દિલ કો ફિકે આખિરત કી આમાજ ગાહ બનાને કે લિયે તથ્બીગે કુરાખાનો સુન્તત કી આલમગીર ગૈર સિયાસી તહરીક દા'વતે ઈસ્લામી કે મ-દની માહોલ સે હર દમ વાબસ્તા રહિયે, મ-દની ઈન્દ્રામાત કે મુતાબિક જિન્દગી ગુજારિયે ઔર સુન્તતોં કી તરબિયત કે મ-દની કાફિલોં કે મુસાફિર બનતે રહિયે, એનું એણાં દોનોં જહાં મેં બેડા પાર હોગા. આપ કી તરફાબ વ તહરીક કે લિયે એક મ-દની બહાર પેશ કી જાતી હે ચુનાન્યે

વીડિયો સેન્ટર ખત્મ કર દિયા

લાંઢી (બાબુલ મદીના, કરાચી) કે મુકીમ ઈસ્લામી ભાઈ કે બયાન કા ખુલાસા હૈ : હમારે અલાકે મેં એક મુખલિયે દા'વતે ઈસ્લામી નેકી કી દા'વત કો આમ કરને કે અગીમ જરૂબે કે તહૂત બડી મુસ્તકિલ મિજાજ સે ચૌક દર્સ દિયા કરતે થે. એક મર્તબા ઉસ ચૌક દર્સ મેં એક વીડિયો સેન્ટર વાલે કો ભી શિર્કત કી સાચાદત હાસિલ હો ગઈ. જબ મુખલિયે દા'વતે ઈસ્લામી ને ફેઝાને સુન્તત કા દર્સ શુરૂઆ

હશમાનો મુખ્યાનો : જિસ ને મુજ પર રોજે જુમુઆ દો સો બાર દુઃકે પાક પઠા
ઉસ ડે દો સો સાલ ડે ગુનાહ મુખ્યાનું હોગે. (કલ્યાણ ઉમ્માલ)

કિયા તો ખૌડે ખુદા ઓર ઈશ્કે મુસ્તફા સે ચَلِ اللَّهُ تَعَالَى عَلَيْهِ وَسَلَّمَ
ભરપૂર, ફિકે આકિબત સે મા'મૂર અલ્ફાઝ તાસીર કા તીર બન કર
“વીડિયો સેન્ટર વાલે” કે દિલ મેં પૈવસ્ત હો ગએ, બા'દે દર્સ જબ
ઈસ્લામી ભાઈયોં ને ઉન પર ઈન્ફિરાદી કોશિશ કરતે હુંએ દા'વતે
ઈસ્લામી કે હફ્તાવાર સુન્નતો ભરે ઈજતિમાઅ કી દા'વત પેશ કી
તો ફૌરન રાજી હો ગએ. ઓર શિર્કત ભી કી જિસ કી બ-ર-કત સે
ઉન મેં તબ્દીલી આને લગી, કુછ હી અર્સે મેં ઉન્હોંને
વીડિયો સેન્ટર ખત્મ કર દિયા ઓર ધારો કા કારોબાર શુરૂઅ કર કે
હલાલ રોજી કી તલબ મેં મશગૂલ હો ગએ.

માલે દુન્યા હે દોનોં જહાં મેં વબાલ, આપ દોલત કી કસરત કા છોડેં ખ્યાલ
કબુ મેં કામ આએગા હરગિઝ ન માલ, હશ્શ મેં ઝરે ઝરે કા હોગા સુવાલ

صَلُّوٰ عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

માલ જમ્બા કરને ન કરને કી સૂરતે

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! માલ જમ્બા કરને ન કરને કી
સૂરતોં કે મુ-તાલિક બારગાહે ર-જવિયત મેં હોને વાલે “સુવાલ
વ જવાબ” કે મુખ્તાલિફ ઈક્તિબાસાત પેશ કરતા હું, એંશાءી اللَّهُ عَزَّوَ جَلَّ
આપ કી મા'લૂમાત મેં બેહદ ઈજાફા હોગા : સુવાલ : એક શાખ્સ જો
અહલો ઈયાલ (યા'ની બાલ બચ્ચે) રખતા હૈ અપની માણાના યા
સાલાના આમદની સે બિલા ઈફરાત વ તફરીત (યા'ની બિજેર કમી
વ જ્ઞિયાદતી કે) અપને બાલ બચ્ચોં પર ખર્ચ કર કે બકાયા ખુદા કી
રાહ મેં દેતા હૈ આઈના કો અહલો ઈયાલ કે વાસિતે કુછ નહીં

કશમાનો મુખ્યતાવા : ﷺ : મુજ પર દુઃખ શરીર પઠો અલ્લાહ રૂતુમ પર રહમત બેજેગા।
(ઈફ્લે આધી)

રખતા, દૂસરા અપની આમદની સે બચ્ચ્યોં પર એક હિસ્સા ખર્ચ કર કે દૂસરા હિસ્સા બૈરાત કરતા ઔર તીસરા હિસ્સા આઈન્દા ઉન કી ઝરતોં મેં કામ આને કી ગરજ સે રખ છોડને કો અચ્છા જાનતા હૈ, ઈન દોનોં² મેં અફ્જલ કૌન હૈ ?

અલ જવાબ : હુસ્ને નિયત (યા'ની અચ્છી નિયત) સે દોનોં² સૂરતે મહમૂદ (બહુત ખૂબ) હૈનું, ઔર બ ઈભિલાફ અહવાલ (યા'ની હાલાત મુખ્તલિફ હોને કી વજહ સે) હર એક (કભી) અફ્જલ, કભી વાજ્બિબ, વ લિહાજા ઈસ બારે મેં અહાદીસ ભી મુખ્તલિફ આઈ ઔર સ-લહે સાલેહ (યા'ની બુજુગાને દીન) કા અમલ ભી મુખ્તલિફ રહા।
أَتُوْلُ وَبِاللَّهِ التَّوْفِيقُ (અલ્લાહ રૂતુમ કી તૌફીક સે મેં કહતા હું) ઈસ મેં કૌદે મુજજુ વ જામેઅ (યા'ની મુખ્તસર વ જામેઅ કૌદે) એ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ (એ શાયા લાલ રૂતુમ) યેહ હૈ કે આદમી દો² કિસ્મ (કે) હૈનું : (1) મુન્ફિરિદ કે તન્હા હો ઔર (2) મુઈલ કે ઈયાલ (યા'ની બાલ બચ્ચે વગેરા) રખતા હો, સુવાલ અગર્યે મુઈલ સે મુ-તાલિક હૈ મગર હર મુઈલ અપને હક્કે નફસ (યા'ની ખુદ અપને બારે) મેં મુન્ફિરિદ ઔર ઉસ પર અપને નફસ (યા'ની અપની જાત) કે લિહાજ સે વોહી અહકામ હૈનું જો મુન્ફિરિદ પર હૈનું લિહાજ દો² નોં કે અહકામ સે બહુસ દરકાર.

﴿1﴾ વોહ અહલે ઈન્કિતાઅ વ તબતુલ ઈલલ્ખાહ અસહાબે તજરીદ વ તફરીદ (યા'ની ઐસે લોગ જિન્હોંને અલ્લાહ રૂતુમ કી ખાતિર હુન્યા સે કનારા કશી ઈભિયાર કર લી હો ઔર ઉન પર અહલો ઈયાલ કી ક્રિમેદારી ન હો યા (ઉન કે અહલો ઈયાલ હી ન હોં) જિન્હોંને અપને રખ સે કુછ (માલ) ન રખને કા અહ્ફ બાંધા (વા'દા કિયા) (ઉન પર અપને અહ્ફ કે સબબ તર્કે ઈદિખાર (યા'ની માલ જમ્બ ન કરના)

કુલાંતિરાની મુખ્યત્વા : મુજ પર કસરતા સે દુર્ઘટે પાક પણો બેશક તુમ્હારા મુજ પર
દુર્ઘટે પાક પણના તુમ્હારે ગુનાણો કે લિયે ભગફિરતા હૈ. (જ્ઞાને સગીર)

લાઝિમ હોતા હૈ અગર કુછ બચા રખેં તો નક્કે અછ્છા (યા'ની વા'દા ખિલાફી) હૈ ઔર બા'એ અછ્છા ફિર જમ્મા કરના જરૂર જો'ફે યકીન સે નાશી (યા'ની યકીન કી કમજોરી કી વજહ સે હૈ) યા ઉસ કા મૂહિમ (યા'ની વહેમ મેં ડાલને વાલા) હોગા, ઐસે (હજરાત) અગર કુછ ભી જખીરા કરેં મુસ્તાહિકે ઈકાબ (યા'ની સર્જા કે હક્કાર) હોં.

﴿2﴾ ફક્ર વ તવક્કુલ જાહિર કર કે સ-દક્કાત લેને વાલા અગર યેહ હાલત મુસ્તામિર (યા'ની બર કરાર) રખના ચાહે તો ઉન સ-દક્કાત મેં સે કુછ જમ્મા કર રખના ઉસે ના જાઈજ હોગા કે યેહ ધોકા હોગા ઔર અથ જો સ-દક્કા લેગા હરામ વ ખખીસ હોગા.

﴿3﴾ જિસે અપની હાલત મા'લૂમ હો કે હાજત સે જાઈજ જો કુછ બચા કર રખતા હૈ નફ્સ (ઉસે તુયાન વ ઈસ્યાન (યા'ની સરકશી વ ના ફરમાની) પર હામિલ હોતા (યા'ની ઉભારતા), યા કિસી મા'સિયત (યા'ની ના ફરમાની) કી આદત પડી હૈ ઉસ મેં ખર્ચ કરતા હૈ તો ઉસ પર મા'સિયત સે બચના ફર્જ હૈ ઔર જબ ઉસ કા યેહી તરીકા મુઅય્યન (યા'ની મુકર્રર) હો કે બાકી માલ અપને પાસ ન રખે તો ઈસ હાલત મેં (ઉસ પર હાજત સે જાઈજ સબ આમદની કો મસારિફે જેર (યા'ની ભલાઈ કે કામોં) મેં સર્જ કર દેના લાઝિમ હોગા.

﴿4﴾ જો ઐસા બે સબ્રા હો કે અગર ઉસે ફાકા પહોંચે તો ગ્રાંડ્યુન્ડ રબ કી શિકાયત કરને લગે અગર્યે સિફ્ફ દિલ મેં, ન જબાન સે, યા તુરુકે ના જાઈજા (યા'ની ના જાઈજ તરીકોં) મિસ્લે સરિકા (યા'ની ચોરી) યા ભીક વગેરા કા મુર-તકિબ હો, ઉસ પર લાઝિમ હૈ કે હાજત કે કદર જમ્મા રખે, અગર પેશાવર હૈ કે રોજ કા રોજ ખાતા હૈ, તો એક દિન કા, ઔર મુલાઝિમ હૈ કે માહવાર મિલતા હૈ યા

કૃત્તમાને મુખ્યાના : ﴿كُلُّ أَنْشَاءٍ تَعْمَلُ عَلَيْهِ دُولَةٌ وَسُلْطَانٌ :﴾ જો મુજબ પર એક દુઃકદ શરીર પછાણે અલ્લાહ હોય તેથી ઉસ ડેલિયે એક કીરત આજ લિખતા હૈ ઓર કીરત ઉદ્ઘાટ પછાડ જિતના હૈ. (આધુર્ભાવ)

મકાનોં દુકાનોં કે કિરાએ પર બસર હૈ કે (કિરાયા) મહીના પીછે આતા હૈ, તો એક મહીને કા ઔર જમીનદાર હૈ કે ફસ્લ (ઇ માહ) યા સાલ પર પાતા હૈ તો ઇ મહીને યા સાલ ભર કા ઔર અસ્લ જરીએ માશ મ-સલન આલાતે હિરફત (યા'ની કામ કે ઔઝાર) યા દુકાન મકાન દેહાત બ કદરે કિફાયત કા બાકી રખના તો મુત્લકન ઉસ પર વાજિમ હૈ.

﴿5﴾ જો આલિમે દીન મુશ્કિયે શર-અ યા મુદ્દાઝેએ બિદ્દાય (બદ મજહબિયત કો રોકને વાલા) હો ઔર બૈતુલ માલ સે રિઝક નહીં પાતા, જૈસા (કે અબ) યહાં હૈ, ઔર વહાં ઉસ કા ગૈર (યા'ની કોઈ દૂસરા) ઈન મનાસિબે દીનિયા (યા'ની દીની મન્સબોં) પર કિયામ ન કર સકે કે ઈફતા (ફતવા દેને) યા દફ્ફાએ બિદાત મેં અપને અવકાત કા સર્જ કરના ઉસ પર ફર્જ ઐન હો ઔર વોહ માલ વ જાએદાદ રખતા હૈ જિસ કે બાઈસ ઉસે ગના (માલી તૌર પર મજબૂતી) ઔર ઈન ફરાઈજ દીનિયા કે લિયે ફારિગુલ બાલી હૈ (યા'ની રોજગાર વગેરા સે બે ફિકી હૈને) કે અગર (સારા હી માલ) ખર્ચ કર દે મોહતાજ કસ્બ (યા'ની કામ કાજ કરને કા મોહતાજ) હો ઔર ઈન ઉમૂર (યા'ની ઈન દીની ફરીજોં કી અદાએગી) મેં ખલલ પડે, ઉસ પર ભી અસ્લ જરીએ કા ઈંજા (યા'ની બાકી રખના) ઔર આમદની કા બ કદરે મજહૂર જમ્મા રખના વાજિબ હૈ.

﴿6﴾ અગર વહાં ઔર ભી આલિમ યેહ કામ કર સકતે હોં તો ઈંજા વ જમ્માએ મજહૂર (હસ્બે જરૂરત માલ જમ્મા કરના ઔર માલ કે જરાએએ બાકી રખના) અગર્યે વાજિબ નહીં મગર અહ્મ વ મુઅક્કદ (સખ્ત તાકીદ કિયા હુવા) બેશક હૈ કે ઈલ્લે દીન વ હિમાયતે દીન કે લિયે ફરાગ બાલ (યા'ની ખુશહાલી), કસ્બે માલ (યા'ની માલ કમાને) મેં ઈશ્તિગાલ (યા'ની મશગૂલ હોને) સે લાખોં દ-રજે અફઝલ હૈ મય્ય

કશમાનો ગુસ્તાક્ષ : જિસ ને હિતાબ મેં મુજ પર દૂરુદે પાડ લિખા તો જબ તાક મેરા નામ ઉસ મેં રહેગા ફિરિશ્ટે ઉસ ડે લિયે ઈસ્તિગ્ફાર કરતે રહેગે. (ત-ભરાની)

હાજા (યા'ની ઈસી કે સાથ) એક સે દો² ઔર સે દો² સે ચાર ભલે હોતે હું, એક (આલિમ) કી નજર કબી ખતા કરે તો દૂસરે (૩-લમા) ઉસે સવાબ (યા'ની સહીહ બાત) કી તરફ ફેર દેંગે, એક (આલિમ) કો મરજ વગૌરા કે બાઈસ કુછ ઉજ્જર પેશ આએ તો જબ ઔર (૩-લમા) મૌજૂદ હું કામ બન્દ ન રહેગા લિધાજા તઅદુદે (૩-લમાએ દીન (૩-લમાએ દીન કી કસરત) કી તરફ ઝરૂર હાજત હૈ.

﴿7﴾ આલિમ નહીં મગર ત-લબે ઈલ્મે દીન મેં મશ્ગૂલ હૈ ઔર કસ્બ મેં ઈશ્તિગાલ (માલ કમાને મેં મશ્ગૂલ હોના) ઉસ (યા'ની ઈલ્મે દીન કી તલબ) સે માનેએ (યા'ની રોકને વાલા) હોગા તો ઈસ પર ભી ઉસી તરફ ઈઞ્ચા વ જમ્મા મસ્તૂર આકદ વ અહમ હૈ. (યા'ની ઉસ કે લિયે ભી હરબે ઝરૂરત માલ જમ્મા કરના ઔર માલ કે ઝરાએએ કો બાકી રખના બહુત અહમ વ ઝરૂરી હૈ)

﴿8﴾ તીન સૂરતોં મેં જમ્મા મન્ના હુઈ, દો મેં વાજિબ, દો મેં મુઅક્કદ (યા'ની તાકીદી ઔર) જો ઈન આઠ (કિસ્મોં) સે ખારિજ હો, વોહ અપની હાલત પર નજર કરે અગર જમ્મા ન રખને મેં ઉસ કા કલ્બ પરેશાન હો, તવજજોહ બ ઈબાદત વ જિકે ઈલાહી મેં ખલલ પડે તો બ મા'નિયે મજૂકૂર બ કદરે હાજત જમ્મા રખના હી અફ્જલ હૈ ઔર અક્સર લોગ ઈસી કિસ્મ કે હું.

﴿9﴾ અગર જમ્મા રખને મેં ઉસ કા દિલ મુ-તફર્િક (યા'ની મુન્તશિર) ઔર માલ કે હિફઝ (યા'ની હિફાજત) યા ઉસ કી તરફ મૈલાન (જુકાવ) સે મુ-તઅલિક હો તો જમ્મા ન રખના હી અફ્જલ હૈ કે અસ્લ મકસૂદ જિકે ઈલાહી કે લિયે ફરાગ બાલ (ફારિગ હોના) હૈ જો ઉસ મેં મુખ્યિલ (ખલલ ડાલને વાલા) હો વોહી મનૂઅ હૈ.

﴿10﴾ જો અસહાબ નુકૂસે મુત્મર્દનાહ (યા'ની અહલે ઈત્મીનાન) હો,

ફરમાણે મુખ્યાં : ﷺ : જિસ ને મુજ પર એક બાર હું એ પાક પણ અલ્લાહ મારું હોય તો લેજતા હૈ. (મુસ્લિમ)

(૩) ન અ-દમે માલ (માલ ન હોને) સે ઉન કા દિલ પરેશાન (હો) ન વુજૂદ માલ (યા'ની માલ હોને) સે ઉન કી નજર (પરેશાન હો), વોહ મુખ્તાર હૈં (યા'ની બા ઈજિયાર હૈં કે ચાહેં તો બક્રિયા માલ સ-દકા વ ઐરાત કર દેં યા અપને પાસ હી રખો).

﴿11﴾ હાજત સે જિયાદા કા મસારિઝે ઘૈર (યા'ની અથી જગહોં) મેં સર્જ (ખર્ચ) કર દેના ઔર જમ્મા ન રખના સૂરતે સિવુમ મેં તો વાજિબ થા બાકી જુમલા સુવર (યા'ની દીગર તમામ સૂરતોં) મેં ઝડૂર મતલૂબ (યા'ની પસન્દીદા), ઔર જોડ કર (યા'ની જમ્મા) રખના ઉસ કે હક મેં ના પસન્દ વ મા'યૂબ કે મુન્ફરિદ કો ઈસ કા જોડના તૂલે અમલ (યા'ની લમ્ભી ઉમ્મીદ) યા હુંબે હુન્યા (યા'ની હુન્યા કી મહિષત) હી સે નાશી (યા'ની પૈદા) હોગા. (મતલૂબ યેહ કે માલ જમ્મા કરના લમ્ભી ઉમ્મીદ યા હુન્યા સે મહિષત હી કી વજહ સે હોગા ઔર યેહ દોનોં સૂરતોં અથી નહીં હું)

હુન્યા કા મુસાફિર

ફરમાને મુસ્તફા : ﷺ : “હુન્યા મેં યું રહ ગોયા તૂ મુસાફિર બલ્કે રાહ ચલતા હૈ ઔર અપને આપ કો કબ્ર મેં સમજ કે સુખ કરે તો દિલ મેં યેહ ખ્યાલ ન લા કે શામ હોગી ઔર શામ હો તો યેહ ન સમજ કે સુખ હોગી.”

(سُنَّتِ تَرمذِي ج ٤ ص ١٤٩ حديث ٢٤٠ دار الفكري بيروت)

તુમ્હે શર્મ નહીં આતી

સુલ્તાને મદીના ને એક મૌકા પર ઈશાદ ફરમાયા : યા આય્હા النَّاسُ أَمَا تَسْتَحْيُونَ : ક્યા તુમ્હેં શર્મ નહીં આતી ? હાજિરીન ને અર્જ કી : યા રસૂલલ્લાહ ! કિસ બાત સે ? ફરમાયા : જમ્મા કરતે હો જો ન ખાઓગો ઔર ઈમારત બનાતે હો તો જિસ મેં ન રહોગો

કશગાને મુખવકા : ﴿كَلَّا إِنَّمَا تَعْمَلُ عَلَيْهِ وَاللَّهُ أَوْسَطٌ﴾ : جા શપસ મુજ પર દુષ્ટ પાક પઢના ભૂલ ગયા વાંચ જનતા કા રાતના ભૂલ ગયા.

(ત-બચાની)

ઔર વોહ આરજૂએ બાંધતે હો જિન તક ન પહોંચોગે ઈસ સે શરમાતે નહીં.

(المُعْجَمُ الْكَبِيرُ لِطَبَرَانِيِّ ج ٢٥ ص ١٧٢ حديث ٤٢١ دار أحياء التراث العربي بيروت)

જબ કોઈ લુકમા લેતા હું.....

હજરતે સચ્ચિદાના ઉસામા બિન જૈદ ને એક મહીને
કે વા'હે પર એક કનીજ સો દીનાર કો ખરીદી, રસૂલુલ્લાહ
સલ્લી લાયા : ક્યા ઉસામા સે તબજ્જુબ નહીં
કરતે જિસ ને એક મહીને કે વા'હે પર (કનીજ) ખરીદી, બેશક ઉસામા
કી ઉમ્મીદ લખ્ખી હૈ, કસમ ઉસ કી જિસ કે હાથ મેં મેરી જાન હૈ ! મૈં
તો જબ આંખ ખોલતા હું યેહ ગુમાન હોતા હૈ કે પલક ઝપકને સે
પહ્લે મૌત આ જાએગી ઔર જબ પિયાલા મુંહ તક લે જાતા હું કભી
યેહ ગુમાન નહીં કરતા કે ઈસ કે રખને તક જિન્દા રહ્યુંગા ઔર જબ
કોઈ લુકમા લેતા હું ગુમાન હોતા હૈ કે ઈસે હલ્ક સે ઉતારને ન
પાઉંગા કે મૌત ઉસે ગલે મેં રોક દેગી, કસમ ઉસ કી જિસ કે હાથ મેં
મેરી જાન હૈ બેશક જિસ બાત કા તુમ્હેં વા'દા દિયા જાતા હૈ જરૂર
આને વાલી હૈ તુમ થકા ન સકોગે.

(الْتَّرْفِيْبُ وَالْتَّرْهِيْبُ ج ٤ ص ١٠٨ حديث ٥١٧٣ دار الفكري ببيروت)

યેહ સબ (તો) મુન્ફરિદ કા બયાન (હૈ) રહા ઈયાલ દાર (તો)
જાહિર હૈ કે વોહ અપને નફસ કે હક મેં “મુન્ફરિદ” હૈ, તો ખુદ
અપની જાત કે લિયે ઉસે ઉન્હીં અહકામ કા લિહાજ ચાહિયે ઔર
ઈયાલ કી નજર સે ઉસ કી સૂરતેં ઔર હું ઉન કા બયાન કરેં.

﴿12﴾ ઈયાલ કી કફાલત શર-અ ને ઈસ પર ફર્જ કી, વોહ ઉન કો

જુથે મુખ્યત્વાની : ﷺ : જિસ કે પાસ મેરા જિક હુવા આર ઉસ ને મુજ પર દુઃખે પાક
ન પછી તહેકીક વોહ બલભાઈ હો ગયા। (ઇધે ચુણી)

તવક્કુલ વ તબતુલ (દુન્યા સે કનારા કશી) વ સંભ અલલા ફાડા (યા'ની
ભૂક ઔર ઘાસ સે સંભ) પર મજબૂર નહીં કર સકતા, અપની જાન કો
જિતના ચાહે કુસે (યા'ની આજમાઈશ મેં ડાલે) મગર ઉન (યા'ની
બાલ બચ્ચોં) કો ખાલી છોડના ઈસ પર હરામ હૈ.

﴿13﴾ વોહ જિસ કી ઈયાલ મેં સૂરતે ચહારુમ કી તરફ બે સંભા હો
ઔર બેશક બહુત અવામ ઐસે નિકલેંગે તો ઈસ કે લિહાજ સે તો ઉસ
પર દૌહરા વુજૂબ હોગા કે કદરે હાજત જમ્મા રખે.

﴿14﴾ હાં જિસ કી સબ ઈયાલ (યા'ની બાલ બચ્ચો) સાબિર વ
મુ-તવક્કિલ હોં (ઉસે રવા (જાઈજ) હોગા કે સબ (માલ) રાહે ખુદા મેં
ખર્ચ કર દે. (ફત્વા ૨-જવિયા, જિ. 10, સ. 311 તા 327, મુજ્જ-સરન)

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! બયાન કો ઈજિતામ કી તરફ
લાતે હુએ સુન્નત કી ફરીલત ઔર ચન્દ સુન્નતેં ઔર આદાબ બયાન
કરને કી સઆદત હાસિલ કરતા હું. તાજદારે રિસાલત, શહિન્શાહે
નુખુલ્યત, મુસ્તફા જાને રહમત, શમ્ખે બજમે હિદાયત, નોશએ બજમે
જન્નત કા ﷺ કરમાને જન્નત નિશાન હૈ : “જિસ ને
મેરી સુન્નત સે મહિષત કી ઉસ ને મુજ સે મહિષત કી ઔર જિસ ને
મુજ સે મહિષત કી વોહ જન્નત મેં મેરે સાથ હોગા.”

(ابن ع્સાକીરજ ૬، ص ૩૪૨، دارالفکر بیروت)

સીના તેરી સુન્નત કા મદીના બને આકા

જન્નત મેં પડોસી મુઝે તુમ અપના બનાના

صَلُّوٰ عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

કશમાને મુખલાકા : ﴿كَلَّا لَنْ تَسْتَأْنَ عَلَيْهِ وَلَا يُوْسُفُ﴾ : જિસ ને મુજ પર દસ મરતાખા સુખ આર દસ મરતાખા શામ દુઃદેયાડપથા ઉસે કિયામત કે ઇન મેરી શક્તાનત મિલેગી.

(મજમાઉંજવાઈં)

“અંગૂઠી કે અહમ અહુકામ” કે સતરણ હુરેક કી નિરબત સે અંગૂઠી કે 17 મ-દની ફૂલ

- ✿ મર્દ કો સોને કી અંગૂઠી પહુંનના હરામ હૈ. સુલ્તાને દો² જહાન,
રહુતે આ-લભિયાન ચીની اللہ تعالیٰ علیહ وَسَلَّمَ ને સોને કી અંગૂઠી પહુંનને
સે મન્ના ફરમાયા. (૦૮૬૩ હિદીષ ૬૭) ✿ (ના બાલિગ)
- ✿ લડકે કો સોને કા જેવર પહુંનાના હરામ હૈ ઔર જિસ ને પહુંનાયા
વોહ ગુનહગાર હોગા. (૦૧૮ હિદીષ ૧૦) ✿ લોહે કી
અંગૂઠી જહાનભિયોં કા જેવર હૈ. (૧૭૧૨ હિદીષ ૩૦૦)
- ✿ મર્દ કે લિયે વોહી અંગૂઠી જાઈજ હૈ જો મર્દી કી અંગૂઠી કી તરહ હો
યા’ની એક નગીને કી હો ઔર અગર ઉસ મેં (એક સે જિયાદા યા)
કઈ નગીને હોં તો અગર્યે વોહ ચાંદી હી કી હો, મર્દ કે લિયે ના જાઈજ
હૈ. (૦૧૭ હિદીષ ૧૦) ✿ ઈસી તરહ મર્દી કે લિયે એક સે જિયાદા
(જાઈજ વાલી) અંગૂઠી પહુંનના યા (એક યા જિયાદા) છલ્લે પહુંના
ભી ના જાઈજ હૈ કે યેહ (છલ્લા) અંગૂઠી નહીં. ઔરતેં છલ્લે પહુંન
સકતી હૈન. (બહારે શરીઅત, હિસ્સા : 16, સ. 71) ✿ ચાંદી કી એક અંગૂઠી
એક નગ કી કે વજ્ઞન મેં સાઢે ચાર માશે (યા’ની ચાર ગ્રામ 374 મિલી
ગ્રામ) સે કમ હો, પહુંનના જાઈજ હૈ અગર્યે બે હાજતે મોહર, (મગર)
ઈસ કા તર્ક (યા’ની જિસ કો સ્ટેમ્પ કી જરૂરત ન હો ઉસ કા ન પહુંનના)
અફઝલ હૈ ઔર મોહર કી ગરજ સે ખાલી જવાઝ નહીં (યા’ની જિન
કો અંગૂઠી સે સ્ટેમ્પ લગાની હો ઉન કે લિયે સિર્ફ જાઈજ હી નહીં) બલ્કે
સુનાત હૈ, હાં તકબ્બુર યા જનાના પન કા સિંગાર (યા’ની લેડીઝ
સ્ટાઇલ કી ટીપટોપ) યા ઔર કોઈ ગ-રઝે મજમૂબ (યા’ની કાબિલે

જ્રસમાણે મુખ્યતા : ﷺ : જિસ તે પાસ મેરા તિક હુવા ઓર ઉસ ને મુજ પર દુકુદ
શરીફ ન પઢા ઉસ ને જફા તી. (આખુદીઝુદ)

મજબૂત મતલબ વ મફાદ) નિયત મેં હો તો એક અંગૂઠી (હી) ક્યા
ઈસ નિયત સે (તો) અચ્છે કપડે પહનને ભી જાઈજ નહીં. (ફતાવા
૨-જવિયા, જિ. 22, સ. 141) ✽ ઈટેન મેં મર્દ કે લિયે ચાંદી કી જાઈજ
વાલી અંગૂઠી પહનના મુસ્તહબ હૈ. (બહારે શરીઅત, જિ. 1, સ. 779,
780, બ તસરુફ મક-ત-બતુલ મદીના બાબુલ મદીના કરાચી) ✽ અંગૂઠી (ઉન્હીં)
કે લિયે સુન્તત હૈ જિન કો મોહર કરને (યા'ની સ્ટેમ્પ STAMP લગાને)
કી હાજત હોતી હૈ, જેસે સુલ્તાન વ કાર્જી ઔર ઉ-લમા જો ફતવે પર
(અંગૂઠી સે) મોહર કરતે (યા'ની સ્ટેમ્પ લગાતે) હૈન, ઈન કે ઈલાવા
દૂસરોં કે લિયે જિન કો મોહર કરને કી હાજત ન હો સુન્તત નહીં
અલબત્તા પહનના જાઈજ હૈ. (فتાવી عالી ગ ٥ ص ٣٣٠)

✽ મર્દ કો ચાહિયે કે અંગૂઠી કા નગીના હથેલી કી તરફ રખે ઔર
ઔરત નગીના હાથ કી પુશ્ત કી તરફ રખે. (الહداية ج ٤ ص ٣٦٧) ✽
ચાંદી કા છલ્લા ખાસ લિબાસે જનાન (યા'ની ઔરતોં કા પહનાવા) હૈ
મર્દીં કો મકરુહ. (યા'ની ના જાઈજ વ ગુનાહ હૈ) (ફતાવા ૨-જવિયા,
જિ. 22, સ. 130) ✽ ઔરત સોને ચાંદી કી જિતની ચાહે અંગૂઠિયાં
ઔર છલ્લે પહન સકતી હૈ, ઈસ મેં વજુન ઔર નગીને કી તા'દાદ કી
કોઈ કેદ નહીં ✽ લોહે કી અંગૂઠી પર ચાંદી કા ખૌલ ચઢા દિયા કે
લોહા બિલકુલ ન દિખાઈ દેતા હો, ઉસ અંગૂઠી કે પહનને કી
મુમા-ન-અત નહીં. (આલમગીરી, જિ. 5, સ. 335) ✽ દોનોં મેં સે કિસી
ભી એક હાથ મેં અંગૂઠી પહન સકતે હૈન ઔર સબ સે છોટી ઊંગલી મેં
પહની જાયે. (رذالسْتَارِج ٩ ص ٥٩٦، بارશِرِيُّت حَصَّ ١٦ ص ٧٠) ✽ મન્તત કા
યા દમ કિયા હુવા ધાત (METAL) કા કડા ભી મર્દ કો પહનના ના

જીશપસ મુજ પર દૂદે પાક પઢના ભૂલ ગયા વાંછ જનતા
કા રાસ્તા ભૂલ ગયા.
(ત-બાના)

જાઈજ વ ગુનાષ હૈ. ◊ મદીનાએ મુનવ્વરહ રાખી યા
અજમેર શરીફ કે છલ્લે ઔર સ્ટીલ કી અંગૂઠી ભી જાઈજ નહીં.
◊ બવાસીર વગૈરા કે લિયે દમ કિયે હુએ ચાંદી કે છલ્લે ભી મર્દો કે
લિયે જાઈજ નહીં ◊ અગર આપ ને ધાત કા કડા યા ધાત કા છલ્લા,
ના જાઈજ અંગૂઠી, યા ધાત કી ઝાંઝર (CHAIN) પહની હૈ તો અભી
અભી ઉતાર કર તૌબા કર લીજિયે.

હજારોં સુન્તતોં સીખને કે લિયે મક-ત-બતુલ મદીના કી
મતબૂઆ દો કુતુબ (1) 312 સફહાત પર મુશ્ટભિલ કિતાબ “બહારે
શરીયત” હિસ્સા 16 ઔર (2) 120 સફહાત કી કિતાબ “સુન્તતોં
ઔર આદાબ” હદિયુતન હાસિલ કીજિયે ઔર પછિયે સુન્તતોં કી
તરબિયત કા એક બેહતરીન જરીઆ દા'વતે ઈસ્લામી કે મ-દની
કાફિલોં મેં આશિકાને રસૂલ કે સાથ સુન્તતોં ભરા સફર ભી હૈ.

લૂટને રહમતોં કાફિલે મેં ચલો સીખને સુન્તતોં કાફિલે મેં ચલો
હોંગી હલ મુશ્કિલોં કાફિલે મેં ચલો ખત્મ હોં શામતોં કાફિલે મેં ચલો

صَلُوْعَلِيُّ الْحَبِيبِ ! صَلَّى اللّٰهُ تَعَالٰى عَلٰى مُحَمَّدٍ

થેણ રિસાલા પઠ કર દૂધશે હો હે દીજિયે

શાદી ગમી કી તકરીબાત, ઈજતિમાઓાત, એ'રાસ ઔર જુલૂસે મીલાદ વગેરા
મેં મક-ત-બતુલ મદીના કે શાંઅને કર્દા રસાઈલ ઔર મ-દની કૂલોં પર મુશ્ટભિલ પેઝલેટ
તકરીમ કર કે સવાબ કમાઈયે, ગાહકોં કો બ નિયતે સવાબ તોહફે મેં દેને કે લિયે અપની
દુકાનોં પર ભી રસાઈલ રખને કા મા'મૂલ બનાઈયે, અખ્યાર ફરોશોં યા બચ્ચોં કે જરીએ
અપને મહલે કે ઘર ઘર મેં માહાના કમ અઝ કમ એક અદદ સુન્તતોં ભરા રિસાલા યા
મ-દની કૂલોં કા પેઝલેટ પહોંચા કર નેકી કી દા'વત કી ધૂમેં મચાઈયે.



الحمد لله رب العالمين والصلوة والسلام على سيد المرسلين أبا عبد الله عاصم الدين ابي العباس العجيبة بدم الله الرحمن الرحيم

ਚੁਨਨ ਕੀ ਬਣਾਏਂ

ਅਖੀਂ ਪ੍ਰਕਾਸ਼ਨਕਾਂ ਤਥਾਂਗੇ ਕੁਝਾਂਨੇ ਚੁਨਨ ਕੀ ਆਖਮਗੀਰ ਹੈਰ ਸਿਧਾਸੀ ਤਹਵੀਕ ਵਾਰੀਤੇ ਈਤਵਾਮੀ ਕੇ ਮਾਫ਼ ਮਲਕੇ ਮ-ਫ਼ਨੀ ਮਾਲੋਬ ਮੌਜੂਦ ਕਚਰਤ ਚੁਨਨਾਂ ਦੀਆਂ ਅੰਦਰ ਸਿਖਾਇ ਜਾਂਦੀ ਹੈ, ਹਰ ਜੂਮਾ'ਰਾਤ ਕੀ ਸ਼ਾਹੇਭਾਲਮ ਦਰਵਾਜ਼ ਕੇ ਪਾਸ, ਮ-ਫ਼ਨੀ ਮਿਛਲ ਚਾਲੀ ਮਸ਼ਿਫ਼ਾਦ ਮੌਜੂਦ ਈਤਵਾ ਕੀ ਨਮਾਜ਼ ਕੇ ਪਾਂਘ ਵਿੱਚੋਂ ਵਾਲੇ ਚੁਨਨਾਂ ਅੰਦਰ ਈਕਿਤਮਾਮ ਮੌਜੂਦ ਚਾਰੀ ਰਾਤ ਚੁਗਾਰਨੇ ਕੀ ਮ-ਫ਼ਨੀ ਈਤਿਜ਼ਾਲ ਹੈ, ਆਖਿਕਾਂ ਨੇ ਰਚੁਲ ਕੇ ਮ-ਫ਼ਨੀ ਕਾਫ਼ਿਲੀਆਂ ਮੌਜੂਨਨਾਂ ਕੀ ਤਰਜਿਥਾਤ ਕੇ ਕਿਥੇ ਸਫਰ ਅੰਦਰ ਰੋਝਾਨਾ ਇਕੇ ਮਹੀਨਾ ਕੇ ਜ਼ਰੀਏ ਮ-ਫ਼ਨੀ ਈਨਾਮਾਮ ਕਾ ਰਿਸਾਲਾ ਪੁਰ ਕਰ ਕੇ ਅਪਨੇ ਧਲਾਂ ਕੇ ਜਿਮਮਾਦਾਰ ਕੀ ਜ਼ਮਾਨ ਕਰਵਾਨੇ ਕਾ ਮਾਮੂਲ ਬਨਾ ਲੀਓਂਦੇ, ਅਖੀਂ ਪ੍ਰਕਾਸ਼ਨਾਂ ਇਸ ਕੀ ਬਨ-ਕਤ ਸੇ ਪਾਵਾਨੇ ਚੁਨਨ ਬਣਨੇ, ਗੁਪਤਾਂ ਦੇ ਨਕਰਤ ਕਰਨੇ ਅੰਦਰ ਈਮਾਨ ਕੀ ਪਿਛਾਵਤ ਕੇ ਕਿਥੇ ਹੁਕਮੇ ਕਾ ਜੇਹੁਨ ਬਨੇਗਾ, ਹਰ ਈਤਵਾਮੀ ਅਥਾਂ ਅਪਨਾ ਯੋਹ ਜੇਹੁਨ ਬਨਾਵੇ ਕੇ “ਮੁੜੇ ਆਪਨੀ ਅੰਦਰ ਸਾਰੀ ਹੁਨਾਂਕਾ ਕੇ ਲੋਗੋਂ ਕੀ ਈਤਵਾਹ ਕੀ ਕੋਚਿਤਾ ਕਰਨਾਂਦੇ” ਅਖੀਂ ਪ੍ਰਕਾਸ਼ਨਾਂ

ਅਪਨੀ ਈਤਵਾਹ ਕੇ ਕਿਥੇ ਮ-ਫ਼ਨੀ ਈਨਾਮਾਮ ਪਰ ਅਮਲ ਅੰਦਰ ਸਾਰੀ ਹੁਨਾਂਕਾ ਕੇ ਲੋਗੋਂ ਕੀ ਈਤਵਾਹ ਕੀ ਕੋਚਿਤਾ ਕੇ ਕਿਥੇ ਮ-ਫ਼ਨੀ ਕਾਫ਼ਿਲੀਆਂ ਮੌਜੂਨ ਕਰਨਾਂਦੇ ਅਖੀਂ ਪ੍ਰਕਾਸ਼ਨਾਂ

ਮਕ-ਤ-ਭਤੁਲ ਮਹੀਨਾ ਕੀ ਸ਼ਾਬੋਂ

ਚੂਰਨ : ਵਲਿਧਾਬਾਈ ਮਸ਼ਿਫ਼ਾਦ, ਪਵਾਖ, ਦਾਨਾ ਦਰਗਾਹ ਕੇ ਪਾਸ, 9898615071

ਅਮਨਗਾਰ : ਪਾਂਥ ਚਾਟੀ, 9327977293

ਮੋਡਾਈ : ਸੁਕਾ ਬੜ੍ਹਾ, 9725824820

ਗਾਂਧੀਧਾਮ : ਸੁਪਨਾ ਨਗਰ, ਮਹੀਨਾ ਮਸ਼ਿਫ਼ਾਦ ਕੇ ਪਾਸ, 8141474279

ਧੀਲਕਾ : ਤਾਜ਼ਹਾਵੇ ਮਹੀਨਾ ਮਸ਼ਿਫ਼ਾਦ ਕੇ ਸਾਮਨੇ, ਟਾਵਰ ਬਾਜ਼ਾਰ, 9374915797

ਸਿੰਕੋਕੇ ਵਾਹਿਕ, ਅਕਿਕ ਕੀ ਮਹਿਰ ਕੇ ਰਾਗੇ, ਗੀਤ ਦਰਵਾਜ਼, ਅਨੁਸਾਰਕਾਲ-1 ਗੁਰਾਂਗ, ਕਾਫਿਲਾ

Ph: 91-79-25391168 E-mail: maktabahind@gmail.com, www.dawateislami.net



SC1266